



Ceylon Government Gazette

Published by Authority.

No. 5,308—FRIDAY, AUGUST 31, 1894.

PART I.—General: Minutes, Proclamations, Appointments, and General Government Notifications.

PART II.—Legal and Judicial.

PART III.—Provincial Administration.

PART IV.—Marine and Mercantile.

PART V.—Municipal and Local.

Separate paging is given to each Part in order that it may be filed separately.

Part III.—Provincial Administration.

Land Sales:—	PAGE		PAGE
Western Province	191	Land Acquisition Notices	211
Central Province... ..	199	Land Resumption Notices	213
Northern Province	—	Notices under "The Forest Ordinance"	—
Southern Province	—	Notices of sale of Arrack, Opium, and Toll Rents	—
Eastern Province	201	Notices of sale of Salt and Timber	—
North-Western Province	205	Notifications of Close Seasons, Infected Areas, &c.	214
North-Central Province	—	Specifications under "The Irrigation Ordinance"	—
Province of Uva	208	Miscellaneous Departmental Notices	—
Province of Sabaragamuwa	210		

LAND SALES IN THE WESTERN PROVINCE.

No. 1,413, W. P.

Colonial Secretary's Office,
Colombo, August 16, 1894.

ON Tuesday, September 25, 1894, at 12 noon, the Assistant Government Agent for the Negombo District will put up for sale or settlement, at Mirigama Resthouse, the under-mentioned portions of Crown Land, on the terms authorized by Government.

Sixty allotments of land situated in the Hapitigam koralé of the Negombo District of the Western Province.

• Preliminary plan 10,140.

Lot.	Village.	Name of Land.	Name of Claimant.	Description.	Extent.		
					A	R.	P.
1	Neligama	Welabodawatta	N Telenis Appu	Cocoanut	0	2	24
2	Do.	do.	A. Hudi Appu	do.	1	0	8
3	Do.	do.	M. Nanhamy and others	do.	0	2	37
4	Do.	do.	A. Sinno Appu and others	do.	0	2	2
5	Do.	do.	A. Hudi Appu	do.	0	2	0
6	Do.	Karandagahakumburapillewa	M. Nanhamy	do.	0	2	13
7	Do.	do.	M. Abaranhamy	do.	0	2	4
8	Do.	do.	do.	do.	0	0	9
9	Do.	Serugahawatta <i>alias</i> Puwak-gahakumburapillewa	M. Grigoris Appu	do.	0	0	15
13	Do.	Gallindawatta	A. Kintohamy and another	do.	0	2	9
14	Do.	Talgahawatta	M. Lokuhamy	do.	1	0	34
15	Do.	Serugahawatta	M. Navatuwa and others	do.	0	0	30

PART III.—Page 191.

C 1

Lot.	Village.	Name of Land.	Name of Claimant.	Description.	Extent.		
					A.	R.	P.
17	Pohonnaruwa	Beligahawatta	H. Sasira	Cocoanut	0	2	15
18	Do.	do.	H. Omaria	do.	0	0	26
19	Do.	do.	Alutennage Aima	do.	0	0	5
20	Neligama	Ketakelagahawatta	A. Hudi Appu	do.	0	1	37
21	Do.	Gallindawatta	U. Gawariya	do.	0	0	33
22	Do.	do.	U. Siriya	do.	0	1	9
23	Do.	do.	U. Unguwa	do.	0	0	25
24	Do.	do.	do.	do.	0	0	2
25	Do.	do.	M. Abaran Appu	do.	0	0	13
28	Do.	do.	Velun Perera, Police Vidane	do.	0	0	23
29	Do.	do.	M. Geris Appu	do.	0	1	17
30	Do.	Bopatagewatta	M. Velun Perera, Police Vidane	do.	0	0	35
31	Do.	Gallindawatta	do.	do.	0	0	10
32	Pohonnaruwa	Ritigahawatta	Pirimanage Siriya	do.	0	2	15
36	Do.	Ihalawatta	Pirimanage Babiya	do.	0	0	12
37	Do.	Ambagahawatta	Pirimanage Labuna	do.	0	0	20
38	Do.	Kahatagahawatta	Pirimanage Balaya	do.	1	1	3
39	Do.	Ambagahawatta	Pirimanage Lokubalaya	do.	0	0	39
40	Do.	Maragahawatta	S. Girensuwa	do.	0	2	34
41	Do.	do.	do.	do.	0	2	32
42	Do.	do.	do.	do.	1	1	32
43	Do.	do.	do.	do.	0	0	25
45	Do.	Delgahawatta	Piramanage Babiya	do.	0	1	21
46	Do.	do.	K. Tepanis Naide	do.	0	1	30
47	Do.	Bokkamulla-aswedduma	do.	Paddy	0	0	38
48	Do.	Delgahawatta	do.	Cocoanut	0	3	23
49	Do.	Bokkemulla-aswedduma	do.	Paddy	0	0	30
50	Do.	Deniyawatta	K. Adonis Naide	Chena	0	0	19
51	Do.	Bokkemulladeniyapillewa	Pirimanage Siriya	Cocoanut	0	0	23
52	Do.	Bokkemulladeniya	do.	Owita	0	0	39
54	Do.	Pansalawatta	K. Ungu Naide, for the pansala	Cocoanut	0	2	25
55	Do.	Deniyakumburapillewa	Piramanage Balaya	do.	0	0	35
56	Do.	Pansalawatta	K. Ungu Naide, for the pansala	do.	0	0	26
58	Do.	Imbulgahadeniya	S. Pinhami and another	Paddy	1	1	6
59	Do.	Delgahawatta	D. Gunaya and another	Cocoanut	0	1	17
60	Do.	Kahatagahawatta	Paulus Amarasekera	do.	0	1	9
61	Do.	do.	do.	do.	1	2	9
63	Palmada	Kahatagahadeniyapillewa	S. Pinhamy	do.	0	0	1
64	Do.	Kahatagahadeniya	do.	Paddy	0	2	31
65	Do.	Kahatagahawatta	do.	Cocoanut	0	1	2
68	Pohonnaruwa	Siyambalagahawatta	V. Harmanis Appu	do.	0	3	34
69	Indiparape	Napelanda	R. Akolis, Police Vidane	do.	0	1	1
70	Do.	Mawatawatta	C. Dingirala Appuhamy	do.	0	2	25
73	Do.	Pattiyawatta	N. M. Meera Lebbe	do.	0	1	24
74	Do.	Siyambalagahawatta	C. Dingirala Appuhamy	do.	1	1	32
75	Do.	Kandawatta	C. Telenis Appuhamy	do.	0	1	16
76	Do.	do.	do.	do.	1	0	28
77	Do.	Nadadeniyawatta	Johannes Chandarasekera	do.	0	3	31

Upset price,—Rs. 10 an acre.

Further information respecting these lands may be obtained from the Surveyor-General, and respecting the conditions of sale from the Assistant Government Agent, Negombo.

By His Excellency the Governor's command,

E. NOEL WALKER,
Colonial Secretary.

No. 1,413, W. P.

වර්ෂ 1894 ක්වු අගෝස්තු මස 16 වෙනි දින කොළඹ

මහසේනාධිපති උන්වහන්සේගේ කන්තෝරුවේදීය.

මහලුදියාවේ ආණ්ඩුවේ උපද්වන්තලන්තාන්සේ විසින් මෙහි පහත සඳහන් වෙන ආණ්ඩුව සන්තක ඉඩම් ආණ්ඩුවේ නියෝගවල ප්‍රකාරයට වර්ෂ 1894 ක්වු සැප්තැම්බර් මස 25 වෙනි දිනවු අගහරුවාද දවල් 12ට පමණ මිටිගම නානාසමේදී වෙන්දේසිකර විකුණන්නට නොහොත් නින්දකරදෙන්ට යෙදෙනවා ඇත.

බස්නාහිරපලානේ මහලු කොට්ඨාසයේ හාපිටිගමකෝරලේ පිහිටාතිබෙන බිම්කැබලි 60ය.

කො.	ඉඩමේ නම.	ගම—නැලිගම. අයිතිකම කියන්නා.	අන්දම.	මහත. අ. රු. ප.
1	වැලබොඩවන්ත	නි. ගෙලේනිස්අස්පු	පොල්	0 2 24
2	එම	අ. ආභිඅස්පු	එම	1 0 8
3	එම	මි. නානාමි සහ තවත්	එම	0 2 37
4	එම	අ. සිඤ්ඤොඅස්පු සහ තවත්	එම	0 2 2
5	එම	අ. ආභිඅස්පු	එම	0 2 0
6	කරදගහකුඹුර පිල්ලාව	වි. නංහාමි	එම	0 2 13
7	එම	ම. අබරන්හාමි	එම	0 2 4
8	එම	එම	එම	0 0 9
9	සේරුවහවන්ත නොහොත් සුවක්ගහකුඹුර පිල්ලාව	මි. ගිරිගෝරිස්අස්පු	එම	0 0 15

නො.	ඉඩමේ නම.	අයිතිකම් කියන්නා.	අත්දීම.	මහත. අ. රු. ප.
13	ගල්ලිදවත්ත	අ. කිත්තොහාමි සහ කෙනෙක්	පොල්	0 2 9
14	තල්ගහවත්ත	මි. ලොකුහාමි	එම	1 0 34
15	සේරුගහවත්ත	මි. නවාකුමා සහ නවත්	එම	0 0 30
		ගම—පොහොන්තොරුව.		
17	බෙලිගහවත්ත	හො. සසිරු	එම	0 2 15
18	එම	හො. ඔවරියා	එම	0 0 26
19	එම	අලුතුන්තෙහෙ සිමා	එම	0 0 5
		ගම—නැලිගම.		
20	කැටකැලගහවත්ත	අ. ආභිඅප්පු	එම	0 1 37
21	ගල්ලිදවත්ත	උ. ගවරියා	එම	0 0 33
22	එම	උ. සිරියා	එම	0 1 9
23	එම	උ. උන්ගමා	එම	0 0 25
24	එම	එම	එම	0 0 2
25	එම	මි. අබරන්අප්පු	එම	0 0 13
28	එම	වෙලුන්පෙරේරු පො. මු.	එම	0 0 23
29	එම	මි. ජීරිස්අප්පු	එම	0 1 17
30	බෝපානගේවත්ත	මි. වෙලුන්පෙරේරු පො. මු.	එම	0 0 35
31	ගල්ලිදවත්ත	එම	එම	0 0 10
		ගම—පොහොන්තොරුව.		
32	රිච්ගහවත්ත	පිරිමානගේ සිරියා	එම	0 2 15
36	ඉහලවත්ත	එම බබියා	එම	0 0 12
37	අඹගහවත්ත	එම ලබුනා	එම	0 0 20
38	කහටගහවත්ත	එම බාලයා	එම	0 1 3
39	අඹගහවත්ත	එම ලොකුබාලයා	එම	0 0 39
40	මාරගහවත්ත	ස. ගිරන්සුවා	එම	0 2 34
41	එම	එම	එම	0 2 32
42	එම	එම	එම	1 1 32
43	එම	එම	එම	0 0 25
45	දෙල්ගහවත්ත	පිරිමානගේ බබියා	එම	0 1 21
46	එම	කි. තෙපානිස් නයිදෙ	එම	0 1 30
47	බොක්කමුල්ල අස්වැද්දුම	කි. තෙපානිස් නයිදෙ	කුඹුර	0 0 38
48	දෙල්ගහවත්ත	එම	පොල්	0 3 23
49	බොක්කමුල්ල අස්වැද්දුම	එම	කුඹුර	0 0 30
50	දෙනියවත්ත	කි. අප්පුනිස් නයිදෙ	හේන	0 0 19
51	බොක්කමුල්ලදෙනිය-පිල්ලාව	පිරිමානගේ සිරියා	පොල්	0 0 23
52	බොක්කමුල්ලදෙනිය	එම	හිසිට	0 0 39
54	පත්සලවත්ත	කි. උන්ගො නයිදෙ (පත්සල වෙනුවට)	පොල්	0 2 25
55	දෙනිය කුඹුර පිල්ලාව	පිරිමානගේ බාලයා	එම	0 0 35
56	පත්සලවත්ත	කි. උන්ගො නයිදෙ (පත්සල වෙනුවට)	එම	0 0 26
58	ඉඹුල්ගහදෙනිය	සේ. පිංහාමි සහ කෙනෙක්	කුඹුර	1 1 6
59	දෙල්ගහවත්ත	දේ. ගුණියා සහ කෙනෙක්	පොල්	0 1 17
60	කහටගහවත්ත	පව්ලස් අමරසේකර	එම	0 1 9
61	එම	එම	එම	1 2 9
		ගම—පල්ලමඩ.		
63	කහටගහදෙනිය පිල්ලාව	සේ. පිංහාමි	එම	0 0 1
64	කහටගහදෙනිය	එම	කුඹුර	0 2 31
65	කහටගහවත්ත	එම	පොල්	0 1 2
		ගම—පොහොන්තොරුව.		
68	සියඹලාගහවත්ත	ඒ. හර්මානිස්අප්පු	එම	0 3 34
		ගම—ඉදිපරපෙ.		
69	නාපෙලන්ද	ර. අකොලිස් පො. මු.	එම	0 1 1
70	මාවතවත්ත	ව. සිත්තිරාල අප්පුහාමි	එම	0 2 25
73	පව්වියවත්ත	න. ම. මිරලබ්බේ	එම	0 1 24
74	සියඹලාගහවත්ත	ව. සිත්තිරාල අප්පුහාමි	එම	1 1 32
75	කන්දවත්ත	ව. තෙලෙනිස් අප්පුහාමි	එම	0 1 16
76	එම	එම	එම	1 0 28
77	දදදෙසිය වත්ත	රේනැන්තස් වැදුසේකර	එම	0 3 31

අක්කරයක් මිලකර තිබෙන්නේ රුපියල් 10ටය.

මේ ඉඩම් ගැණ වැඩිදුර කාරණා සර්වේයර්ජනරාල් උත්තාන්සේගෙන්ද, විකිනීමේ කොන්දේසි ගැණ කාරණා මිහච්චේ ආණ්ඩුවේ උපදේපත්තලාන්තාන්සේගෙන්ද දැනගතයැකීමේ.

ආණ්ඩුකාර උතුමානත්වහන්සේගේ ආඥාවලෙස,
 ජ. නොඑල් වාකර්,
 මහසෙනෙහිපාලි විමල.

No. 1,414, w. p.

Colonial Secretary's Office,
Colombo, August 16, 1894.

ON Wednesday, September 26, 1894, at 12 noon, the Assistant Government Agent for the Negombo District will put up for sale or settlement, at the Mirigama Resthouse, the under-mentioned portions of Crown Land, on the terms authorized by Government.

Sixty allotments of land situated in the Hapitigam korale of the Negombo District of the Western Province.

Preliminary plan 10,140.

Lot.	Village.	Name of Land.	Name of Claimant.	Description.	Extent.		
					A.	R.	P.
78	Indiparape	Radadeniyakumbura	Johannes Chandarasekara	Paddy	0	2	6
79	Do.	Radadeniyawatta	do.	Cocoanut	0	0	27
80	Do.	do.	do.	do.	0	1	5
84	Hiriwala	Wewahenawatta	D. D. P. Amarasekara	do.	0	0	7
85	Do.	do.	do.	do.	0	0	4
86	Do.	do.	do.	do.	0	3	3
91	Lindara	Gallindawatta	D. Baronchy Appuhamy	do.	0	0	15
93	Do.	Ketakelegahawatta	D. Sardiell Appu and another	do.	0	1	14
95	Pannalapatiya	Bukanawatta	D. P. Amarasekara	do.	0	3	32
98	Palmada	Kahatagahawatta	S. Telenis Appu and another	do.	0	2	15
99	Do.	do.	do.	do.	0	0	36
100	Do.	do.	do.	do.	0	0	10
101	Do.	Imbulgahawatta	S. Karanis Appu	do.	0	1	37
102	Do.	Nugagahawatta	do.	do.	0	0	18
103	Do.	do.	do.	do.	0	2	13
104	Do.	do.	do.	do.	1	1	16
105	Do.	do.	S. Telenis Appu and another	do.	0	0	25
106	Do.	Ambagahawatta	S. Sinno Appu and another	do.	1	0	3
107	Do.	Ketahelagahawatta	M. Isan Appu	do.	1	0	3
108	Do.	do.	S. Samuel Appu	do.	0	1	22
109	Do.	Siyambalagahawatta	V. Ukkurala	do.	1	1	13
110	Do.	Kahatagahawatta	S. Samuel Appu and another	do.	0	3	19
112	Henapola	Gorakamullawatta	K. Banchappu	do.	0	2	6
113	Do.	Ambagahawatta	K. Punchi Sinno Appu	do.	0	2	20
114	Do.	Rendagewatta	K. Loku Sinnappu and another	do.	0	3	35
115	Do.	do.	do.	do.	0	1	15
116	Do.	Ambalamgodellawatta	G. Amaris Appu	do.	0	0	20
117	Do.	Rendagewatta	L. Sanchi Naide	do.	0	1	22
118	Do.	Kongahawatta or Migahawatta	V. Allis Appu and another	do.	0	1	27
121	Do.	Ambagahawatta	K. Seenchi Appu	do.	0	0	38
123	Do.	Delgollawatta	E. Allensuwa	do.	0	2	11
124	Do.	Delgollakele	R. Juanis Appu	do.	0	3	11
126	Do.	Delgahawatta	K. Lewis Appu	do.	0	3	16
128	Pamunuwatta	Puwakwattalanda	D. Dillohamy and another	do.	0	0	30
129	Do.	Puwaklandawatta	do.	do.	0	1	26
130	Hidiyavala	Kindiwalakumburapillewa	A. Siman Appu	do.	0	2	32
130½	Do.	do.	do.	do.	0	1	39
132	Do.	Hingurudolawatta	Musipaturage Henchi	do.	0	0	18
138	Henapola	Liangugahawatta	M. Sinno Appu	do.	0	1	0
141	Do.	Dematagahawatta	G. Nugahamy	do.	0	0	26
143	Do.	Hunugodayayakumbura	Appu Sinno, Police Vidane	Paddy	0	1	34
144	Do.	do.	G. Nugahamy	do.	1	1	24
147	Weweldeniya	Dambuwakele	Tamby Lebbe Asana Lebbe	Cocoanut	0	0	8
148	Do.	Dombagahawatta	P. Sinno Naide	do.	0	0	16
150	Do.	Siyambalagahawatta	P. Baba Appu and two others	do.	0	1	4
151	Do.	Wewehenawatta	E. Nanhonda	do.	0	1	32
152	Do.	Kandawattakele	E. Unga	do.	0	2	1
153	Do.	Kandawatta	V. Allis Appu	do.	0	3	21
154	Henapola	do.	do.	do.	0	3	11
155	Do.	do.	do.	Jungle	0	1	4
156	Do.	do.	do.	Cocoanut	1	0	28
157	Do.	do.	do.	Chena	0	2	27
159	Do.	Kahatagahawatta	K. Sinno Appu	Cocoanut	0	0	31
160	Do.	Illukgollawatta	K. Velun Appu	do.	0	3	11
166	Do.	Kahatagahawatta	V. Nonohamy	do.	0	1	26
167	Do.	do.	L. Appurala	Chena	0	0	15
168	Do.	do.	L. Appurala and two others	Cocoanut	0	3	16
169	Do.	do.	V. Allis Appu	do.	1	0	10
170	Do.	Marakkotuwa	N. Sinno Appu	do.	0	3	18
171	Do.	Bunwalewatta	do.	do.	0	2	35

Upset price,—Rs. 10 an acre.

Further information respecting these lands may be obtained from the Surveyor-General, and respecting the conditions of sale from the Assistant Government Agent, Negombo.

By His Excellency the Governor's command,

E. NOEL WALKER,
Colonial Secretary.

No. 1,414, w. P.

වෂ 1894 ක්වු අඟෝස්තු මස 16 වෙනි දින කොළඹ
මහසෙනුකාරිස්ථානයන්සේසේ කන්තෝරුවේදීය.

මෙහි දිසාවේ ආණ්ඩු වි උපස්ථාන උපනාන්සේ විසින් මෙහි පහත සදහන්වන ආණ්ඩුව සන්තක බඩම
ආණ්ඩුවේ නියෝගවල ප්‍රකාරයට වෂ 1894 ක්වු සැප්තැම්බර් මස 26 වෙනි දිනවූ බදුදු දවල් 12ව මිලියන
කානාංගම්දී වෙන්දේසිකර විකුණන්ට තෙදෙනවා ඇත.

බස්නාහිර පලාතේ මහවුකොට්ඨාසයේ හා පිටිගම් කෝරලේ පිහිටා තිබෙන බිම්කැබලි 60ක.
සිතියම 10,140. ගම—දුදිපරපෙ.

නො.	බඩමේ නම.	අයිතිකම් කියන්නා.	අන්දම.	මහත. අ. රු. ප.
78	රදදෙනිය කුඹුර	ජෙනරාල් ජයවර්ධන	කුඹුර	0 2 6
79	රදදෙනිය වත්ත	එම	පොල්	0 0 27
80	එම	එම	එම	0 1 5
ගම—හිරිවල.				
84	වැවේසේනේ වත්ත	ඩී. ඩී. ජී. අමරසේකර	එම	0 0 7
85	එම	එම	එම	0 0 4
86	එම	එම	එම	0 3 3
ගම—ලික්දර.				
91	ගල්ලිය වත්ත	දී. බාරොන් අප්පුහාමි	එම	0 0 15
93	කැටකැලගහවත්ත	දී. සර්දේසල් අප්පු සහ කෙනෙක්	එම	0 1 14
ගම—පන්නලපිටිය.				
95	බුක්කවත්ත	ඩී. පී. අමරසේකර	එම	0 3 32
ගම—පල්මඩ.				
98	කහවගහවත්ත	ජේ. ගෙලේනිස් අප්පු සහ කෙනෙක්	එම	0 2 15
99	එම	එම	එම	0 0 36
100	එම	එම	එම	0 0 10
101	ඉඹුල්ගහවත්ත	ජේ. කරණිස් අප්පු	පොල්	0 1 37
102	භුගහවත්ත	එම	එම	0 0 18
103	එම	එම	එම	0 2 13
104	එම	එම	එම	1 1 16
105	එම	එම	එම	0 0 25
106	අඹගහවත්ත	ජේ. සිසිල් ජයවර්ධන	එම	1 0 3
107	කැටකැලගහවත්ත	වී. ජයවර්ධන	එම	1 0 3
108	එම	ජේ. සාමෙල් අප්පු	එම	0 1 22
109	සිසඹලංග වත්ත	වී. උත්තුරාල	එම	1 1 13
110	කහවගහවත්ත	ජේ. සාමෙල් අප්පු සහ කෙනෙක්	එම	0 3 19
ගම—හේනේපොල.				
112	ගොරකලල වත්ත	කු. බන්වල්පු	එම	0 2 6
113	අඹගහවත්ත	ක. පුත්තිසිසිල් ජයවර්ධන	එම	0 2 20
114	රේන්දරේ වත්ත	ක. ලොකුසිසිල් ජයවර්ධන සහ කෙනෙක්	එම	0 3 35
115	එම	එම	එම	0 1 15
116	අම්බලම්ගොඩවල්ල වත්ත	ග. අමරසේකර	එම	0 0 20
117	රේන්දරේ වත්ත	ලී. සාන්තිනිධිදේ	එම	0 1 22
118	කෝන්ගහවත්ත නොහොත් මිහනවත්ත	වී. අල්ලිස් අප්පු සහ කෙනෙක්	එම	0 1 27
121	අඹගහවත්ත	ක. සිත්ති අප්පු	එම	0 0 38
123	දෙල්ගොල්ලවත්ත	ඊ. අලුත්සුවා	එම	0 2 11
124	දෙල්ගොල්ලකැලේ	ර. පුත්තිස් අප්පු	එම	0 3 11
126	දෙල්ගහවත්ත	ක. ලුසිස් අප්පු	එම	0 3 16
ගම—පමුනුවත්ත.				
128	පුවක්වත්ත ලන්ද	දී. දිලෝහාමි සහ කෙනෙක්	එම	0 0 30
129	පුවක්ලන්ද වත්ත	එම	එම	0 1 26
ගම—හිරිපවල.				
130	බන්දිවලකුඹුර පිල්ලාව	අ. සිමන් අප්පු	එම	0 2 32
130½	එම	එම	එම	0 1 39
132	චිතුරුදෙලවත්ත	මුසිපත්පුරගේ හෙත්ති	පොල්	0 0 18
ගම—හේනේපොල.				
138	ලියඟහවත්ත	මී. සිසිල් ජයවර්ධන	එම	0 1 0
141	දෙවමගහවත්ත	ග. උත්තුරාල	එම	0 0 26
143	හුනුගොඩසාස කුඹුර	අප්පුසිසිල් ජයවර්ධන, පො. මු	කුඹුර	0 1 34
144	එම	ග. උත්තුරාල	එම	1 1 24
ගම—වේවැල්දෙනිය.				
147	දුඹුකැලේ	නම්බලෙඹිබේ අසන්නාලෙඹිබේ	පොල්	0 0 8
148	දෙඹගහවත්ත	ප. සිසිල් ජයවර්ධන	එම	0 0 16
150	සිසඹලාගහවත්ත	ප. බන්වල්පු සහ දෙදෙනෙක්	එම	0 1 4
151	වැවේසේනේවත්ත	ඊ. නාහොද	එම	0 1 32
152	කන්දවත්තකැලේ	ඊ. උත්තා	එම	0 2 1
153	කන්දවත්ත	වී. අල්ලිස් අප්පු	එම	0 3 21

නො.	ඉඩමේ නම.	අයිතියක් කියන්නා.	අන්දම.	මහක. අ. ර. ප.
		ගම—පෙන්නේපොල.		
154	කන්දවත්ත	ඒ. අල්ලියඅප්පු	පොල්	0 3 11
155	එම	එම	කැලේ	0 1 4
156	එම	එම	පොල්	1 0 28
157	එම	එම	පෙන්න	0 2 27
159	කහටහනවත්ත	ක. සිසිදකොආප්පු	පොල්	0 0 31
160	ඉලුක්කොල්ලවත්ත	ක. වෙලුන්අප්පු	එම	0 3 11
166	කහටහනවත්ත	ඒ. තෝනොහාමි	එම	0 1 26
167	එම	ලී. අප්පුරාල	එම	0 0 15
168	එම	එම සහ දෙදෙනෙක්	පොල්	0 3 16
169	එම	ඒ. අල්ලියඅප්පු	එම	1 0 10
170	මරක්කොටුව	කී. සිසිදකොආප්පු	එම	0 3 18
171	බුන්වලේවත්ත	එම	එම	0 2 35

අක්කරසක් මිලකර තිබෙන්නේ රුපියල් 10 වස.
 මෙම ඉඩම් ගැණ වැඩිදුර කාරණා සර්වේච්ඡන්දනලත්තාන්පේශෙන්ද, විකිනීමේ කොන්දේසි ගැණ කාරණා මතමුවේ ආණ්ඩුවේ උපද්විජ්ජනලත්තාන්පේශෙන්ද දැනගත හැකිවේ.

ආණ්ඩුකාර උතුමානවත්තන්පේශෙන්ද අඥවලෙස,
 ඊ. නොඑල් වාකර,
 මහසෙනෙකාරිප් වමිස.

No. 1,415, W. P. Colonial Secretary's Office,
 Colombo, August 16, 1894.

ON Thursday, September 27, 1894, at 12 noon, the Assistant Government Agent for the Negombo District will put up for sale or settlement, at the Mirigama Resthouse, the under-mentioned portions of Crown Land, on the terms authorized by Government.

Fifty-four allotments of land situated in the Hapitigam korale of the Negombo District of the Western Province.

Preliminary plan 10,140. Village—Palmada.

Lot.	Name of Land.	Name of Claimant.	Description.	Extent.		
				A.	R.	P.
172	Kahatagahawatta	K. Nonohamy	Cocoanut	0	0	21
174	Millagahawatta	M. Babanis Appu	do.	0	1	25
175	Delgahawatta	R. Livinis Appu	do.	0	2	7
177	Do.	do.	do.	0	1	19
178	Ritigahawatta	do.	do.	0	0	22
179	Siyambalagahawatta	M. Punchappuhamy	do.	0	1	23
180	Kahatagahawatta	M. Suanchi Appu	do.	0	1	7
181	Do.	M. Punchi Sinno	do.	0	1	34
182	Do.	M. Suanchi Appu	do.	0	0	23
183	Siyambalagahawatta	V. Velun Appu	do.	0	1	38
184	Do.	V. Balahamy	do.	0	0	18
186	Do.	do.	do.	0	0	22
189	Do.	V. Sardial Appu	do.	0	3	22
191	Kongahawatta	do.	do.	2	1	5
193	Gonnagahawatta	S. Karanis Appu and two others	do.	0	0	36
194	Do.	do.	do.	0	1	34
195	Delgahawatta	K. Appu Sinno	do.	0	3	32
198	Do.	H. Unguhamy	do.	0	3	16
200	Millagahawatta	V. Sinchi Appu	do.	0	1	12
201	Do.	do.	do.	0	0	33
202	Do.	do.	do.	0	0	1
203	Do.	do.	do.	0	0	1
Village—Kaleliya.						
204	Kadurugahawatta	Charles Appu	do.	0	0	33
Village—Hapitigama.						
207	Indiwinawatta	I. Punchina	do.	0	0	21
208	Etakeheldolakumbura	G. Baronchi Appu	Paddy	0	0	5
209	Do.	do.	do.	0	0	6
210	Do.	G. Isan Appu	do.	0	0	4
211	Do.	G. Pinhamy	do.	0	0	2
212	Do.	Elias Police Vidane	do.	0	0	1
213	Do.	G. Baba Sinno Appu and others	do.	0	0	12
214	Panwattēkumburapillewa	I. Punchina	Cocoanut	0	0	4
Village—Kaleliya.						
215	Kirimetiawatta	Livinis Perera	do.	0	0	3
Village—Midellakotuwa.						
217	Galabodawatta or Gorakagahawatta	W. Matiya	do.	0	1	26

Lot.	Name of Land.	Name of Claimant.	Description.	Extent. A. R. P.
		Village—Hapitigama.		
218	Galabodalanda or Kabata-gahawatta	W. Mana and three others	Cocoanut	0 0 14
219	Delgahawatta	Tango Nachchire	do.	0 0 3
220	Do.	G. Elenis Appu and another	do.	0 2 4
221	Do.	G. Amaris Appu	do.	0 1 34
222	Do.	do.	do.	0 0 5
223	Do.	do.	do.	0 2 11
225	Do.	G. Isan Appu	do.	0 1 27
227	Beligahawatta	J. Pelis Appu	do.	0 0 23
228	Do.	do.	do.	0 0 31
229	Kahatagahawatta	J. Sudana	do.	0 0 32
		Village—Makkanigoda.		
233	Batalawatta	L. Sinnappu	do.	0 1 10
234	Delgahawatta	M. Sinnappu	do.	0 0 10
		Village—Henapola.		
237	Kiripallegahakumbura	N. Velun Appu	Paddy	2 0 39
238	Do.	V. Appurala	do.	2 1 25
239	Do.	H. L. Dasanayaka, Mudaliyar	do.	3 0 11
		Village—Makkanigoda.		
242	Harankahatennawatta	Estate of the late Mr. J. Obesekera	Cocoanut	0 2 22
244	Kanuhetawatta	Julis Appulamy	do.	0 0 27
		Village—Bataliya.		
244	Kanuhetekumburapillewa	Niwatuwage Velun Appu	do.	0 0 2
245	Dambuawatta	R. Pina and another	do.	3 3 34
246	Kirikokmadittawatta	L. Babiya	do.	0 1 0
		Village—Weweldeniya.		
247	Do.	do.	do.	0 1 4

Upset price,—Rs. 10 per acre.

Further information respecting these lands may be obtained from the Surveyor-General, and respecting the conditions of sale from the Assistant Government Agent, Negombo.

By His Excellency the Governor's command,

E. NOEL WALKER,
Colonial Secretary.

No. 1,415, W. P.

වර්ෂ 1894 න්වැනි අගෝස්තු මස 16 වෙනි දින කොළඹ

මහසෙනෙවුකාරීජ්ජාන්තාන්සේගේ කන්තෝරුවේදී.

මෙහි දී සාමාන්‍ය ආණ්ඩුවේ උපදේශනානුකූලව පවත්වාගෙන යාමට විසින් මෙහි පහත සඳහන්වන ආණ්ඩුව සන්තක ඉඩම් ආණ්ඩුවේ නියෝගවල ප්‍රකාරයට වර්ෂ 1894 න්වැනි අගෝස්තු මස 27 වෙනි දින වූ බ්‍රහස්පතින්දා දවම 12ට පමණ මිලට නානාසමේදී වෙන්දේසි කර විකුණනට නොහොත් නිවැරදි කරගෙන යාමට යෙදෙනවා ඇත.

බස්නාහිර පලාතේ මෙහි කොට්ඨාසයේ හා පිටිමහකෝරලේ පිහිටා තිබෙන බිම් කැබලි 54ය.

සියලුම 10,140. ගම—පල්මඩ.

කො.	ඉඩමේ නම.	අයිතිකම් කියවන්නා.	අන්දම.	ආ. රු. ප.
172	කහවගහවත්ත	ක. නෝනාහාමි	පොල්	0 0 21
174	මිල්ලගහවත්ත	ම. බබානිස්අප්පු	එම	0 1 25
175	දෙල්ගහවත්ත	රු. ලිච්චිස්අප්පු	එම	0 2 7
177	එම	එම	එම	0 1 19
178	ඊවිගහවත්ත	එම	එම	0 0 22
179	සියඹලගහවත්ත	ම. පුත්වජ්ජාහාමි	එම	0 1 23
180	කහවගහවත්ත	ම. සුආන්විඅප්පු	එම	0 1 7
181	එම	ම. පුත්විසිඤ්ඤෝ	එම	0 1 34
182	එම	ම. සුආන්විඅප්පු	එම	0 0 23
183	සියඹලගහවත්ත	වි. වෙලුන්අප්පු	එම	0 1 38
184	එම	වි. බාලහාමි	එම	0 0 18
186	එම	එම	එම	0 0 22
189	එම	වි. සර්දියෙල්අප්පු	එම	0 3 22
191	කෝන්ගහවත්ත	එම	එම	2 1 5
193	ගොන්නගහවත්ත	සේ. කරනිස්අප්පු සහ දෙදෙනෙක්	එම	0 0 36
194	එම	එම	එම	0 1 34
195	දෙල්ගහවත්ත	ක. අප්පුසිඤ්ඤෝ	එම	0 3 32
198	එම	ගෙ. උන්ගුහාමි	එම	0 3 16
200	මිල්ලගහවත්ත	වි. සිත්විඅප්පු	එම	0 1 12
201	එම	එම	එම	0 0 33
202	එම	එම	එම	0 0 1
203	එම	එම	එම	0 0 1

නො.	ඉඩමේ නම.	අයිතිකම කියන්නා.	අන්දම.	මහත. අ. රු. ප.
204	කදුරුගහවත්ත	ගම—කල්ප්ලිය. චාර්ල්ස් අප්පු	පොල්	0 0 33
207	ඉදිවිභුවත්ත	ගම—හාපිටිගම. ඉ. පුත්තිනා	එම	0 0 21
208	ඇටකොහෙල්දොල කුඹුර	ග. බාරොන් වි අප්පු	කුඹුර	0 0 5
209	එම	එම	එම	0 0 6
210	එම	ග. ජයන් අප්පු	එම	0 0 4
211	එම	ග. පින්නාමි	එම	0 0 2
212	එම	එලියස්, පො. මු.	එම	0 0 1
213	එම	ග. බබාසිස්සෝ අප්පු සහ තවත්	එම	0 0 12
214	පත්වත්තේ කුඹුර පිල්ලුව	ඉ. පුත්තිනා	පොල්	0 0 4
215	කිරිමැටියවත්ත	ගම—කල්ප්ලිය. ලිවිනිස් ප්ලෙරු	එම	0 0 3
217	ගලබොඩවත්ත නොහොත් ගොරකගහවත්ත	ගම—මිදුල්ල කොටුව. වි. මාරියා	එම	1 0 26
218	ගලබොඩලන්ද නොහොත් කහට ගහවත්ත	ගම—හාපිටිගම. වි. මනාසහ තුන්දෙනෙත්	එම	0 0 14
219	දෙල්ගහවත්ත	තන්ගොනාවිවිටේ	එම	0 0 3
220	එම	ග. එලේනිස් අප්පු සහ කෙනෙත්	එම	0 2 4
221	දෙල්ගහවත්ත	ග. අමාරිස් අප්පු	පොල්	0 1 34
222	එම	එම	එම	0 0 5
223	එම	එම	එම	0 2 11
225	එම	ග. ජයන් අප්පු	එම	0 1 27
227	බෙලිගහවත්ත	ජ. පැලිස් අප්පු	පොල්	0 0 23
228	එම	එම	එම	0 0 31
229	කහටගහවත්ත	ඉ. සුදනා	එම	0 0 32
233	බකලවත්ත	ගම—මක්කානිගොඩ. ලි. සිසිස්සු අප්පු	එම	0 1 10
234	දෙල්ගහවත්ත	වි. සිසිස්සු අප්පු	එම	0 0 10
237	කිරිපලල්ලගහ කුඹුර	ගම—පේත්පොල. කී. වෙලුන් අප්පු	කුඹුර	2 0 39
238	එම	වි. අප්පුරාල	එම	2 1 25
239	එම	එච්. ආර්. දසනාසක මුදලි	එම	3 0 11
242	ගරත්තනකැත්තවත්ත	ගම—මක්කානිගොඩ. නැසිගිය ජේ. උබේසේකර මහත්	පොල්	0 2 22
244	කහුහැත්තේවත්ත	මයාගේ මුදලේට අයිති ජිලිස් අප්පුගාමි	එම	0 0 27
244½	කහුහැත්තේ කුඹුර පිල්ලුව	ගම—බටලිය. නිවානුවගේ වෙලුන් අප්පු	එම	0 0 2
245	දඹුවත්ත	රු. පිනාසහ කෙනෙත්	එම	3 3 34
246	කිරිකොත්මදිත්තවත්ත	ලි. බබියා	එම	0 1 0
247	එම	ගම—වේවාල් දෙකිය. එම	එම	0 1 4

අත්කරගත් මිලකර තිබෙන්නේ රුපියල් 10ක බැගින්.

මේ ඉඩම් ගැන වැඩිදුර කාරණා සර්වේපර් ජනරාල් උන්වහන්සේගෙන්ද, විකිනීමේ කොන්දේසි විභාගණ මිගමුල ආණ්ඩු උපද්විජන උන්වහන්සේගෙන්ද දැනගත හැකිවේ.

ආණ්ඩුකාර උතුමානන්වගන්සේගේ ආඥාවලෙස,

ජ. කොප්ල් වාකර්,
මහසෙනෙකාරීජ වමිහ.

LAND SALES IN THE CENTRAL PROVINCE.

No. 1,428, C. P.

Colonial Secretary's Office,
Colombo, August 14, 1894.

ON Wednesday, October 10, 1894, at 12 noon, the Assistant Government Agent, Nuwara Eliya, will put up to auction, at his Office in Nuwara Eliya, the under-mentioned portions of Crown Land, on the terms authorized by Government.

Two allotments of land situated in the Udagampaha korale of Uda Hewaheta in the District of Nuwara Eliya, Central Province.

Preliminary plan 4,531.

Lot.	Name of Land.	Village.	Name of Applicant.	Description.	Extent. A. R. P.
12094	Nugadandahinna	Wellagiriya	G. M. Ballardie	Patana and patches of mukalana	40 0 0
12096	do.	do.	do.	Patana	9 1 31

Upset price,—Rs. 50 per acre.

Further information respecting these lands may be obtained from the Surveyor-General, and respecting the conditions of sale from the Assistant Government Agent, Nuwara Eliya.

By His Excellency the Governor's command,
E. NOEL WALKER,
Colonial Secretary.

No. 1,428, C. P.

වර්ෂ 1894 ක්වූ අගෝස්තු මස 16 වෙනි දින කොළඹ

මහසෙනෙවරියාණයාණන්ගේ කන්දෝරුවේදීය.

මධ්‍යම දිසාවේ නුවරඑළියේ උපඵ්ජනනඋත්තරාණයේ විසින් මෙහි සහක සඳහන්වෙන ආණ්ඩුව සන්තක ඉඩම් ආණ්ඩුවේ නියෝගවල ප්‍රකාරයට වර්ෂ 1894 ක්වූ ඔක්තෝබර් මස 10 වෙනි වූද්දින දවල් 12ට නුවරඑළියේ කවිච්චියේදී වෙන්දේසිකර විකුණනට යෙදෙනවා ඇත.

මධ්‍යම දිසාවේ නුවරඑළියේ උඩකේවාහැටේ පලාතේ උඩගම්පහකෝරලේ කොට්ඨාසයේ පිහිටා තිබෙන බිම්කැබලි දෙකක්.

සිතියම 4,531. ගව—වෙල්ලගිරිය. අයිතිකම කියන්නා—ආණ්ඩුව.

නො.	ඉඩමේ නම.	ඉල්ලුම්කාරයා.	අත්දම.	මහත. අ. රු. ප.
12094	නුගදන්දේසියන්ත	ජී. ඇම්. බලර්ඩ්	පහත සහ මුකලන් තීරු	40 0 0
12096	එම	එම	පහත	9 1 31

අක්කරයක් රුපියල් 50ගේ හිට විකුණනට පටන්ගනු ලැබේ.

මේ ඉඩම් ගැණ වැඩිදුර කාරණ සර්වේයර්ජනරල් උත්තරාණයාණන්ගේ දැනගත් පුළුවන්වත් ඇර එකිනීමේ කොන්දේසි ගැණ තොරතුරු නුවරඑළියේ උපඵ්ජනනඋත්තරාණයාණන්ගේ දැනගත හැකිවේ.

ආණ්ඩුකාර උතුමානන්වගන්ගේ ආඥාවලෙස,
ඒ. නොඑල් වාකර්,
මහසෙනෙවරියාණයාණන්ගේ.

No. 1,429, C. P.

Colonial Secretary's Office,
Colombo, August 17, 1894.

ON Wednesday, September 26, 1894, at 12 noon, the Assistant Government Agent, Nuwara Eliya, will put up to auction, at his office in Nuwara Eliya, the under-mentioned portions of Crown Land, on the terms authorized by Government.

Five allotments of land situated in the Uda Hewaheta division of the Nuwara Eliya District of the Central Province.

Preliminary plan 4,505.

Lot.	Village.	Name of Applicant.	Name of Claimant.	Description.	Extent. A. R. P.
12045	Ranakola	Urumbegedara Puma	Crown	Land fit for paddy	2 0 0
12046	Do.	Eripetiyegeedara Kiri Menika	do.	do.	2 0 34
12047	Do.	Medagedara Kiri Menika	do.	do.	1 3 33
12048	Do.	Sirimala Duraya	do.	do.	2 0 37
12049	Do.	Wattagodagedara Puncheda	do.	do.	1 0 34

Upset price,—Rs. 15 per acre.

Further information respecting these lands may be obtained from the Surveyor-General, and respecting the conditions of sale from the Assistant Government Agent, Nuwara Eliya.

By His Excellency the Governor's command,
E. NOEL WALKER,
Colonial Secretary.

No. 1,429, C. P.

වර්ෂ 1894 ක්වූ අගෝස්තු මස 17 වෙනි දින කොළඹ මහසෙනෙවිතුමා විසින් පවත්වනු ලැබූ භූමි භාවිතයේදී.

මධ්‍යම දිසාවේ නුවරඑළියේ උපළුපත්කරුන්ගේ විසින් මෙහි පහත සඳහන්වන ආණ්ඩුව සන්තක ඉඩම් ආණ්ඩුවේ නියෝගවල ප්‍රකාරයට වර්ෂ 1894 ක්වූ සැප්තැම්බර් මස 26 වෙනි දින වූ බදුද 12කට නුවරඑළියේ කවිවෙරියේදී වෙන්දේසිකර විකුණන්නට යෙදෙනවා ඇත.

මධ්‍යම දිසාවේ නුවරඑළිය පලාතේ උඩගේවාහැවේ කොට්ඨාසයේ පිහිටා තිබෙන බිම්කැබේලි 5ක්. සිතියම 4,505. අයිතිකම කියන්නා—ආණ්ඩුව.

කො.	ගම.	ඉල්ලුම්කාරයාගේ නම.	අන්දම.	මහත. අ. රු. ප.
12045	මානකොල	උරුමේගෙදර පිපුමා	වි ගොසිතැනට සැකෙන ඉඩම	2 0 0
12046	එම	එරිපිටියේගෙදර කිරිමැනිකා	එම	2 0 34
12047	එම	මැදගෙදර කිරිමැනිකා	එම	1 3 33
12048	එම	සිරිමලාදුරයා	එම	2 0 37
12049	එම	වටගොඩගෙදර පුත්තා	එම	1 0 34

අක්කරයක් රූපියල් 15 සිට විකුනනු ලැබේ. මෙම ඉඩම් ගැන වැඩිදුර කාරණා සර්වේයර්පනරුලුපත්තාන්සේගෙන්ද, විකිනීමේ කොන්දේසි ගැන කාරණා මධ්‍යම දිසාවේ නුවරඑළියේ උපළුපත්කරුන්ගේ විසින් දැනගන්නට පුළුවන.

ආණ්ඩුකාර උතුමානන්වහන්සේගේ ආඥාවලෙස,
ඊ. නොඑල් වාකර්,
මහසෙනෙවිතුමා විසින් වම්ග.

No. 1,430, C. P.

Colonial Secretary's Office,
Colombo, August 24, 1894.

ON Wednesday, October 10, 1894, at 12 o'clock, the Assistant Government Agent for Nuwara Eliya will put up to auction, at his Office in Nuwara Eliya, the under-mentioned portions of Crown Land, on the terms authorized by Government.

Two allotments of land situated in the Walapane division of the Nuwara Eliya District of the Central Province. Preliminary plan 4,481.

Lot.	Village.	Name of Applicant.	Name of Claimant.	Description.	Extent. A. R. P.
11991	Rasingolle	P. B. Alawatugoda	Crown	Boutique	0 0 3.35
11992	Do.	do.	do.	do.	0 0 1

Upset price,—Rs. 100 per acre.

Further information respecting these lands may be obtained from the Surveyor-General, and respecting the conditions of sale from the Assistant Government Agent, Nuwara Eliya.

By His Excellency the Governor's command,
E. NOEL WALKER,
Colonial Secretary.

No. 1,430, C. P.

වර්ෂ 1894 ක්වූ අගෝස්තු මස 24 වෙනි දින කොළඹ මහසෙනෙවිතුමා විසින් පවත්වනු ලැබූ භූමි භාවිතයේදී.

මධ්‍යම දිසාවේ නුවරඑළියේ උපළුපත්කරුන්ගේ විසින් මෙහි පහත සඳහන්වන ආණ්ඩුව සන්තක ඉඩම් ආණ්ඩුවේ නියෝගවල ප්‍රකාරයට වර්ෂ 1894 ක්වූ ඔක්තෝබර් මස 10 වෙනි දින වූ බදුද දවල් 12ට නුවරඑළියේ කවිවෙරියේදී වෙන්දේසිකර විකුණන්නට යෙදෙනවා ඇත.

මධ්‍යම දිසාවේ නුවරඑළිය පලාතේ වලපනේ කොට්ඨාසයේ පිහිටා තිබෙන බිම්කැබේලි දෙකක්. සිතියම 4,481. අයිතිකම කියන්නා—ආණ්ඩුව.

කො.	ගම.	ඉල්ලුම්කාරයා.	අන්දම.	මහත. අ. රු. ප.
11991	රාසිගොල්ල	පී. බී. අලුවතුරගොඩ	කඩේ	0 0 3.25
11992	එම	එම	එම	0 0 1

අක්කරයක් රූපියල් 100යේ සිට විකුනන්නට පටන්ගනු ලැබේ.

මෙම ඉඩම් ගැන වැඩිදුර කාරණා සර්වේයර්පනරුලුපත්තාන්සේගෙන්ද, විකිනීමේ කොන්දේසි ගැන කාරණා නුවරඑළියේ ආණ්ඩුවේ උපළුපත්කරුන්ගේ විසින් දැනගන්නට පුළුවන.

ආණ්ඩුකාර උතුමානන්වහන්සේගේ ආඥාවලෙස,
ඊ. නොඑල් වාකර්,
මහසෙනෙවිතුමා විසින් වම්ග.

LAND SALES IN THE EASTERN PROVINCE.

No. 492, E. P.

Colonial Secretary's Office,
Colombo, August 17, 1894.

ON Friday, September 28, 1894, at noon, the Assistant Government Agent for the Trincomalee District, Eastern Province, will put up to auction, at his Office in Trincomalee, the under-mentioned portions of Crown Land, on the terms authorized by Government.

Twenty-nine allotments of land situated in the Kaddukkulam and Koddigar divisions of the Trincomalee District of the Eastern Province.

Preliminary plan 1,909.

Lot.	Village.	Name of Claimant.	Description.	Extent. A. R. P.
6255	Tiriyai	Umapati Sapapati (applicant)	Paddy field	4 2 24
6256	Do.	Manikkavasakar Mahataver (applicant)	do.	2 0 0
Preliminary plan 1,910.				
6257	Tiriyai	S. Appachichipillai (applicant)	Paddy field	3 3 18
6258	Do.	do.	do.	0 1 27
Preliminary plan 1,911.				
6259	Tiriyai	S. Arunasalam (applicant)	Forest	2 0 27
6260	Do.	do.	Chena	0 0 28
Preliminary plan 776.				
G 319	Pulmoddai	Katiyar Umarumma	Cocoanut and bare ground	0 0 24
S 320.	Do.	M. Sankarapillai	Cocoanut	0 0 39
Preliminary plan 790.				
O 321	Tennamaravadi	K. P. H. Kasinater	Paddy	1 2 0
P 321	Do.	Ariyar Sitampari	do.	2 1 28
Q 321	Do.	Vellapper Konamalai	do.	2 0 32
S 321	Do.	P. H. Kasinater's wife Valliyammai	do.	1 0 22
T 321	Do.	V. V. Velapper Vinnaitirtan and one	do.	1 2 36
9554	Do.	Murukan Murukeser (applicant)	do.	1 2 15

The following lots are re-advertised for non-payment of instalments.

Preliminary plan 728.				
K 300	Tiriyai	—	Cocoanut	0 1 27
8940	Do.	—	Open with three plants	0 1 9
Preliminary plan 748.				
U 309	Kumpurupiddi	—	Cocoanut and waste	0 2 37
9204	Do.	—	Open	0 0 11
Preliminary plan 720.				
A 297½	Kuchchaveli	—	Cocoanut and open	0 0 2
C 297½	Do.	—	Cocoanut	0 0 2
8865	Do.	—	A hut and open	0 0 20
Preliminary plan 1,620.				
4539	Mutur	—	Waste	0 0 23
4542	Do.	—	Garden	0 1 20
Preliminary plan 975.				
P 352	Mutur	—	Open land	0 0 30
S 354	Do.	—	Cocoanut garden	1 2 10
Preliminary plan 1,630.				
4734	Mutur	—	Cocoanut	1 0 15
Preliminary plan 1,785.				
5747	Kaddaiparichchan	—	Jungle	1 3 19
Preliminary plan 1,824.				
5839	Sampur	—	Low jungle	2 1 35
5840	Do.	—	Garden	0 2 2

Further information regarding these lands may be obtained from the Surveyor-General, and respecting the conditions of sale from the Assistant Government Agent, Trincomalee.

By His Excellency the Governor's command,

E. NOEL WALKER,
Colonial Secretary.

No. 492, E. P.

கொலோனியல் சர்க்கரித்தாரா ஆபீசில்,
கொழும்பு, 1894 ம் வருஷ ஆவணிமீ 17 ந் வ.

1894 ம் ஆண்டு புரட்டாகிமாதம் 28 ந் தித்தியாகிய வெள்ளிக்கிழமை மத்தியானம் தன ஆபீசில் கீழ் மாகாணத்து திரிகோணமலை உதவி கவர்ணமேநது ஏசுநறவாசுளால் இதனடியிற் சொல்லப்பட்டிருக்கிற முடிக்குரிய காணத்துண்டுசீன, அசாட்சியாரால் உத்தரவுபண்ணப்பட்டிருக்கும் பொருத்தப்பிரகாரம் ஏலத்திற் கூறி விற்கப்படும்.

29 காணித்துண்டுகள், கீழ் டாகாணத்து திரிகோணமலை டிஸ்கிறிருக்கின கட்டுக்குளம் கொட்டியாரா பகுதிகளில் விருக்கினறது.

இல.	குறிச்சி.	பிளான இலக்கம்	உரித்தாளியின் பெயர்.	விவரம்.	வீசாலம்.
6255	திரியாய	பிளான இலக்கம் 1,909.	உரித்தாளியின் பெயர்.	உமாபதி சபாபதி (கேள்விகாரன்) நெற்காணி	4 2 24
6256	ஓடி			மாணிக்கவாசகா மகாதேவா	2 0 0
6257	திரியாய	பிளான இலக்கம் 1,910.	சி. அபயாச்சிப்பிள்ளை (கேள்விகாரன்)	ஓடி	3 3 18
6258	ஓடி			ஓடி	0 1 27
6259	திரியாய	பிளான இலக்கம் 1,911.	அருணாசலம் (கேள்விகாரன்)	காடு	2 0 27
6260	ஓடி			சேனை	0 0 28
G 319	புலமோட்டை	பிளான இலக்கம் 776.	கத்தியா உமறுமமா	தென்னமபிள்ளையு	
S 320	ஓடி		சங்கரப்பிள்ளை	புலனதரையும்	0 0 24
O 321	தென்னமரவடி	பிளான இலக்கம் 790.	காசிநாதா	தென்னமபிள்ளை	0 0 39
P 321	ஓடி		ஆரியாசிதம்பரி	நெற்காணி	1 2 0
Q 321	ஓடி		வேலப்பா கோணமலை	ஓடி	2 1 28
S 321	ஓடி		காசிநாதா பெண் வளரியம்மை	ஓடி	2 0 32
T 321	ஓடி		வட்டவீதான செலயா விளைதீர்த	ஓடி	1 0 22
9554	தென்னமரவடி		தாணு மறுபேரும	ஓடி	1 2 36
	ஓடுக்குப்பணங் கட்டாதபடியால் திருமய விற்பனவுக்கு போடப்பட்டது.				
K 300	திரியாய	பிளான இலக்கம் 728.	—	முருகா முருகேசா (கேள்விகாரன்) நெற்காணி	1 2 15
8940	ஓடி			தென்னமபிள்ளை	0 1 27
				புலமும் மூன்று தென்னம பிள்ளையும	0 1 9
U 309	கும்புறுப்பிட்டி	பிளான இலக்கம் 748.	—	தென்னமபிள்ளையு	
9204	ஓடி			வெறுநதரையும்	0 2 37
				வெளியான தரை	0 0 11
A 297½	குச்சுவெளி	பிளான இலக்கம் 720	—	தென்னமபிள்ளையு	
				ம வெறுந்தரையும	0 0 2
C 297½	ஓடி			தென்னமபிள்ளை	0 0 2
8865	ஓடி			ஒரு குடினும் வெளியானதரையும	0 0 20
4539	மூதூர்	பிளான இலக்கம் 1,620.	—	வெறும்புலம்	0 0 23
4542	ஓடி			தோட்டதரை	0 1 20
P 352	மூதூர்	பிளான இலக்கம் 975.	—	திறப்பானதரை	0 0 30
S 354	ஓடி			தென்னமபிள்ளை	
				தோட்டம்	1 2 10
4734	மூதூர்	பிளான இலக்கம் 1,630.	—	தென்னமபிள்ளை	1 0 15
5747	கட்டைபறிச்சான	பிளான இலக்கம் 1,785.	—	காடு	1 3 19
5839	சம்பூர்	பிளான இலக்கம் 1,824.	—	பறடைக்காடு	2 1 35
5840	ஓடி			தோட்டம்	0 2 2

இந்தக்காணிகளைப்பற்றி மேலதிகமாக அறியவேண்டியவற்றை அளவைத்தலைவரிடத்திலும் நிபந்தனைகளைப்பற்றி திரிகோணமலை உதவி ஏசுநறுத்தரை யவர்களிடத்திலும் கேட்டறிந்துகொள்ளலாம்.

அகியுத்தம் தேசாதிபதியவர்களினது கட்டளையின்படி,

ஈ. நோவல உவாக்கா,
இராசாங்க லிசிடர்.

No. 493, E. P.

Colonial Secretary's Office,
Colombo, August 27, 1894.

ON Tuesday, November 20, 1894, and the following days, the Government Agent for the Eastern Province will put up to auction, at his Office in Batticaloa, the under-mentioned portions of Crown Land, on the terms authorized by Government.

Thirty-four allotments of land situated in the Batticaloa District of the Eastern Province.

Preliminary plan 10.—Manmunai.
Village—Ponnankaintoddam.

Lot.	Name of Applicant.	Description.	Extent.
			A. R. P.
702	V. V. Velappodi	Fit for paddy	8 3 14
709	Do.	do.	9 3 8
713	Do.	do.	9 2 27
714	Do.	do.	9 1 21
717	Do.	do.	7 0 25
720	Do.	do.	7 2 12

Preliminary plan 1,203.

Village—Chotiankoddu.

2470	M. Pichchaikandu	do.	3 3 20
------	------------------	-----	--------

Preliminary plan 923.—Koralai.

Village—Kalkuda.

11408	Silva	Jungle	1 3 39
11410	Do.	do.	1 3 17
11412	Do.	do.	2 0 10
11414	Do.	do.	1 3 33
11416	Do.	do.	2 0 17
11418	Do.	do.	1 3 35
11420	Do.	do.	1 3 15
11422	Do.	do.	2 0 0
11424	Do.	do.	2 0 4
11426	Do.	do.	1 3 38

Preliminary plan 889.—Eraur.

Village—Vantarumulai.

10780½	Mr. E. N. Atherton	Fit for cocoanut	0 0 38
--------	--------------------	------------------	--------

Preliminary plan 1,561.

Village—Vantarumulai.

4240	T. K. Chinnattampi	Fit for cocoanut	1 3 7
------	--------------------	------------------	-------

Preliminary plan 1,866.—Koralai.

Village—Pettalai.

V 48	K. Kanapati	Velliadippuval	1 1 22
6092	General sale	Velladippuval-kadu	0 0 36
6093	A. Periatampi	Kalladivalavu	0 1 12
6094	General sale	Koviladikkadu	0 1 6
W 48	Pettalai Vedas	Amman Pilliar kovil	0 0 34
X 48	Vettier Malikan	Koviladippumi	0 0 21
Y 48	V. Kantappan	Mutiriadivalavu	0 0 27
Z 48	K. Kantan	Pilavadiyalavu	0 2 15
6095	N. Yyramuttu	Mutiriadivalavu	0 0 29
6096	V. Nakapper	Veppadivalavu	0 2 29
6097	N. Velan	Vempuvalavu	0 0 23
6098	V. Vaitilinkam	do.	0 0 39
6099	A. Chinnappillai	Navaladivalavu	0 0 25
6100	A. Chinnattampi	Vellaadipival	0 3 13

Preliminary plan 667.—Porativu.

Village—Mandur.

7925	S. Kantappan	Fit for paddy	7 3 18
------	--------------	---------------	--------

Further information regarding these lands and conditions of sale may be obtained from the Government Agent, Batticaloa.

By His Excellency the Governor's command,

E. NOEL WALKER,
Colonial Secretary.

No. 493, E. P.

கொ. சுகநிறத்தார் ஆபிசில்,
கொழும்பு, 1894 ஆ' ஆவணிமீசம் 27 வ.

1894 ம ஆண்டு கார்த்திகைமீசம் 20 ந தேதியாகிய செவ்வாய்க்கிழையிலு மதனையுதத நாடகனிலும் கிழக்கு மாகாணத்து கவறணமேந்து ஏசனறவர்கள தனது ஆபிசில் இதனடியிற சொல்லப்படடிருக்கிற முடிக்குரிய காணித்துண்டுகளை, அரசாட்சியாரால உ தரவுபண்ணப்படடிருக்கும் பொருததப பிரகாரம ஏலத்திறகூறி விற்றபா.

காணித்துண்டுகள், கிழக்குமாகாணத்து பட்டக்க ளபடி மஸ்திறிங்கி லிருக்கினறன.

பட்டம் 10, மண்முனைப்பறறு.

குறிச்சி—பொன்னாங்காணித்தோட்டம்.

* இல.	கேள்விககாரன.	கிவரம்.	அ. நா. ப.	விசாலம்.
702	வ. வி. வேலாப் போடி	வேளாண மைச்செய்கைக் கேற்றது	8 3 14	
709	செடி	செடி	9 3 8	
713	செடி	செடி	9 2 27	
714	செடி	செடி	9 1 21	
717	செடி	செடி	7 0 25	
720	செடி	செடி	7 2 12	

பட்டம் 1,203.

குறிச்சி—சோதையனகடல்.

2470	மீ. பிச்சைச்சுண்டு வேளாண மைச்செய்கைக் கேற்றது	3 3 20
------	---	--------

பட்டம் 923, கோறலை.

குறிச்சி—உலசூடா.

11408	சிலவா	காடு	1 3 39
11410	செடி	செடி	1 3 17
11412	செடி	செடி	2 0 10
11413	செடி	செடி	1 3 33
11416	செடி	செடி	2 0 17
11418	செடி	செடி	1 3 35
11420	செடி	செடி	1 3 15
11422	செடி	செடி	2 0 0
11424	செடி	செடி	2 0 4
11426	செடி	செடி	1 3 38

பட்டம் 889, ஏறூர்.

குறிச்சி—வந்தாறுமுலை.

10780½	அதட்டனதுரை யவர்கள்	தென்னமபி ளளைக்கேற் றப்பூமி	0 0 38
--------	--------------------	----------------------------	--------

பட்டம் 1,561.

4240	தொ. க. சினனத தம்பி	தென்னமபி ளளைக்கேற் றப்பூமி	1 3 7
------	--------------------	----------------------------	-------

பட்டம் 1,866, கோறலைப்பறறு.

குறிச்சி—பேத்தாளி.

V 48	க. சணவது	வெள்ளைய டிப்புவல	1 1 22
6092	பொதுவிற்பனவு	வெள்ளைய டிக்காடு	0 0 36
6093	அ. பெரியதம்பி	சல்லோடை வளவு	0 1 12
6094	பொதுவிற்பனவு	கோல்லடிக்க காடு	0 1 6
W 48	பேத்தாளி வெடா கள்	அமமனகோ வீல	0 0 34

இல.	கேள்விக்காரன்.	விவரம்.	விசாலம்.
			அ. ரூ. ப.
X 48	வெள்ளையா மாணிக்கன்	கோவிலடி பூழி	0 0 21
Y 48	வ. கந்தப்பன்	முதிரையடி வளவு	0 0 27
Z 48	க. கந்தன்	பலாவடி வளவு	0 2 15
6095	ந. வைரமுத்து	முதிரையடி வளவு	0 0 29
6096	வ. நாகப்பா	வேபட்டி வளவு	0 2 29
6097	நா. வெலன்	வேபட்டி வளவு	0 0 23
6098	வி. வயித்திலிங்கம்	செடி	0 0 39
6099	அ. சிணைப்பிள்ளை	நாவலடி வளவு	0 0 25
6100	அ. சிணைத்தம்பி	வெள்ளையடி பூவல்	0 3 13
7925	ச. கந்தப்பன்	வேளாண்மைச் செய்கைகடேற்றது	7 3 18

இக்காணிகளைப்பற்றிய மேலதன்மான் விளம்பரங்களையும் விற்பனைக் கொந்திசுகளையும்பற்றி மட்டக களப்பு அரசாட்சியின் ஏசனறுததுரை யவர்களிடம் வினாவு அறிந்துகொள்ளலாம்.

அகியுத்தம் தேசாதிபதியவர்களது கட்டளைபடி,
ஈ. நோவெல் உவாககார,
இராசாங்க விதிகா.

No. 494, E. P. Colonial Secretary's Office,
Colombo, August 28, 1894.

ON Thursday, November 1, 1894, and the following days, the Government Agent for the Eastern Province will put up to auction, at his Office in Batticaloa, the under-mentioned portions of Crown Land, on the terms authorized by Government.

Preliminary plan 561.
Description—Fit for paddy.

Lot.	Village.	Name of Applicant.	Extent.
			A. R. P.
5865	Chittandikudi	K. Kumaravelu	2 3 25
5866	Do.	do.	3 0 9
5867	Do.	do.	6 2 24
5868	Do.	do.	18 1 31
5869	Do.	do.	15 1 12
5889	Vantarumulai	General sale	5 2 35
5890	Do.	do.	14 2 21
5892	Do.	do.	18 2 0
5893	Do.	do.	11 2 33
5895	Do.	do.	5 2 37
5897	Do.	do.	37 0 0
497	Chittandi	Preliminary plan 1,029. Description—Jungle. Cruze	1 2 34
4247	Chittandi	Preliminary plan 1,564. Description—Jungle. Cruze	1 0 4
6106	Koraikkallimadu	Preliminary plan 1,870.—Koralai pattu. Description—Vannankenikadu. M. Karuval	2 3 19
3682	Kalkuda	Preliminary plan 1,460. Description—Jungle. General sale	6 0 0
10104	Periaturai	Preliminary plan, 850.—Manmunai. Description—Jungle. Katirkaman	1 1 0
10105	Do.	do.	6 2 34

Lot.	Village.	Name of Applicant.	Extent.
			A. R. P.
10106	Periaturai	General sale	7 2 7
10107	Do.	do.	6 1 18
10111	Do.	do.	2 1 24
883½	Otiankuda	Preliminary plan 1,050. Description—Jungle. General sale	2 3 32
884½	Do.	do.	4 2 14
3165	Kurinchamunai	Preliminary plan 1,335.—Manmunai. Description—Jungle and open land. M. Ismalevvai	40 3 21
7021	Mantikadu	Preliminary plan 632. Description—Pandikhalamulai. V. Sinnattampy	2 3 0
3842	Muravodai	Preliminary plan 1,477.—Koralai pattu. Description—Cultivated with paddy. Encroachment by owner of T. P. 116,446	11 2 0
4112	Pankudavili	Preliminary plan 446.—Eraur pattu. Description—Kalladikulattupumi below Puttampuri tank. I. M. Ivuraim	36 3 30

Further information regarding these lands and conditions of sale may be obtained from the Government Agent, Batticaloa.

By His Excellency the Governor's command,

E. NOEL WALKER,
Colonial Secretary.

No. 494, E. P. கோ. சககிந்ததார ஆபிசில்,
கொழும்பு, 1894 ஓவ ஆவணிமீ 28 உ.

1894 ம ஆகஸ்ட் கார்த்திகைமாதம் 1 நாடகியாகிய வி யாமுககிழமைபிலு மத்தனையித்த நாடகளிலும் கிழ ளு மாகாணத்தது கவற்றாமேந்து ஏசனறுவாகள த்து ஆபிசில் இதனடியிற் சொல்லப்படடிருக்கிற முடி சூரிய காணித் துணடுகளை, அரசாட்சியாரால் உத்தர வுபண்ணப்பட்டிருக்கும் பொருத்தப்பிரகாரம் ஏவத் திற்குறி விற்பாரா.

காணித்துணடுகள், கிழ்க்கூடு மாகாணத்தது மட்டகக் ளாப்பு டில திறக்கி விருக்கின்றன.

படம் 561.

விவரம்—வேளாண்மைச்செய்யகைகடேற்றபூழி.

இல.	சூழிச்சி.	கேள்விக்காரன்.	விசாலம்.
			அ. ரூ. ப.
5865	சிறுமுண்டிமுடி	க. குமாரசுவலு	2 3 25
5866	செடி	செடி	3 0 9
5867	செடி	செடி	6 2 24
5868	செடி	செடி	18 1 31
5869	செடி	செடி	15 1 12
5889	வந்தாறுமூலை	பொருத்திற் பனவு	5 2 35
5890	செடி	செடி	14 2 21
5892	செடி	செடி	18 2 0
5893	செடி	செடி	11 2 33
5895	செடி	செடி	5 2 37
5897	செடி	செடி	37 0 0

படம் 1,029.

497	சிறுமுண்டிமுடி	சூருசு	1 2 34
4247	சிறுமுண்டிமுடி	சூருசு	1 0 4
6106	விவரம்—கொண்டணைக்கேணிக்காரி. கோரகலவிமடு	மு. கறுவல்	2 3 19

இல.	சூறிச்சி.	கேள்வீக்காரன.	அ. நூ.ப.	வீசாலம.
		படம 1,460.		
3682	சற்குடா	பொதுவீற் பனவு	6 0 0	
		படம 850, மண்முனைப்பற்று.		
10104	பெரியகுறை	சுதிராகாமன	1 1 0	
10105	ஹெ	ஹெ	6 2 34	
10106	ஹெ	பொதுவீற் பனவு	7 2 7	
10107	ஹெ	ஹெ	6 1 18	
10111	ஹெ	ஹெ	2 1 24	
		படம 1,050.		
883½	ஓடியங்குடா	பொதுவீற் பனவு	2 3 32	
884½	ஹெ	ஹெ	4 2 14	
		படம 1,335.		
		விவரம்—காம வெடடையும.		
3165	சூரிஞ்சாமுனை	மு. இஸ்மர வெவலை	40 3 21	

இல.	சூறிச்சி.	கேள்வீக்காரன.	அ. நூ.ப.	வீசாலம.
		படம 632.		
7021	விவரம்—பண்ட மங்கிகட்டி	ககாலேமுலை. வி. ஈனன ததமபி	2 3 0	
		படம 1,477 கோறளைப்பற்று.		
3842	விவரம்—தவளாண்மைசெய்த பூமி. யிராவோடை	116,446 நொ மடா படத் தி னுநத் தாளன கூ டடிப பீடி சத்தபூமி	11 2 0	
		படம 446, ஏறாபற்று.		
4112	விவரம்—கலவரகஞ்சுளத்தப்பூமி. பங்குடாவெளி	இவராயின	36 3 30	
		இக்காணிகளைப்பற்றிய மேலதனைமால் க்ளம்பரங் களையும் வற்பணவின் கொந்தீச்சுகளையும்பற்றி மட்டக்க ளப்பு அரசாட்சி ஏசுணறுத்தூரை யுவர்களிடம் வீனுவ ஆறிந்துகொள்ளலாம்.		
		அகியுத்தம தேசாதிபதியவர்களு க்டடலைபயி, ஈ. நோவெல உவராசா, இராசார்க் விதிதா.		

LAND SALES IN THE NORTH-WESTERN PROVINCE.

No. 1,104, N.-W. P.

Colonial Secretary's Office,
Colombo, August 16, 1894.

ON Tuesday, October 23, 1894, at 12 noon, the Government Agent for the North-Western Province will put up to auction, at his Office in Kurunégala, the under-mentioned portions of Crown Land, on the terms authorized by Government.

Three allotments of land situated in the divisions noted below of the Kurunégala District of the North-Western Province.

Preliminary plan 1,926.—Katugampola hatpattu.

Lot.	Village.	Name of Land.	Name of Claimant.	Description.	Extent.		
					A.	R.	P.
9823	Dehigama	Kosgahamulahena	The Crown	Chena	6	1	32
		Preliminary plan 1,959.—Hiriyala hatpattu.					
9904	Wetakuluwawa	Gettuwanaelahena	The Crown	Chena	9	2	9
		Preliminary plan 1,961.—Hiriyala hatpattu.					
9907	Pubbowa	Kongahamulahena	The Crown	Cherta	3	0	27

Upset price,—Rs. 10 per acre.

Further information regarding these lands may be obtained from the Surveyor-General, and respecting the conditions of sale from the Government Agent, North-Western Province.

By His Excellency the Governor's command,

E. NOEL WALKER,
Colonial Secretary.

No. 1,104, N.-W. P.

வழி 1894 க்வி அனெசீது மச 16 வெநி டின காலெடு

மகசெதுகாரீசீடனவானசேசே கன்சைர்லுவேடிச.

புது டிசாவே அனெசீதுவெ லீசீனகரனவானசே வசீவ் வெகி பகன கடினவெவன அனெசீதுவெ சனகக ஓவெமி அனெ
புவெ கியேவெலெ புகாடெவெ வழி 1894 க்வி மன்சைர்லுவெ மச 23 வெநி டினவெ அனெகரலுவெடி டிவெல் 12வெ கர
காலெடு காவெரீசேடி வெவெடிசீகர வினெசீவெ வெடிவெவெ டிவெ.

වයඹ දිසාවේ කුරුනෑගල පළාතේ මෙහි පහත සඳහන්වූ කොට්ඨාසවල පිහිටා තිබෙන බිම්කැබලි 3ක් සිතියම 1,926. කටුගම්පල හත්පත්තුව. අයිතිකම නිසන්තා—රජයට අයත්.

නො.	ගම.	ඉඩමේ නම.	අන්දම.	මහත.
			හේන	අ. රු. ප.
9823	දෙහිගම	කොස්ගහමුල්ල හේන	හේන	6 1 32
9904	වැටකුළුවාව	සිතියම 1,959. හිරිපාලහත්පත්තුව. ගැට්ටුවාන ඇලහේන	එම	9 2 9
9907	පුම්බෝව	සිතියම 1,961. කෝන්ගහමුල්ල හේන	එම	3 0 27

නියමකරනලද මුදල අක්කරයකට රුපියල් දහයයි.

මෙම ඉඩම් ගැන වැඩිදුර කාරණා සර්වේසර්ජන්තුල්ලන්තාත්සේගෙන්ද, විකිනීමේ කොන්දේසි ගැන කාරණා කුරුනෑගල ආණ්ඩුවේ ඒජන්තලන්තාත්සේගෙන්ද දැනගන්නට පුළුවන.

ආණ්ඩුකාර උතුමානන්වගන්සේගේ ආඥාවලෙස,
ඊ. නොඑල් වාකර්,
මහසෙනෙවරිය වමින.

No. 1,105, N.-W. P.

Colonial Secretary's Office,
Colombo, August 14, 1894.

ON Tuesday, October 16, 1894, at noon, the Government Agent for the North-Western Province will put up to auction, at his Office in Kurunegala, the under-mentioned portions of Crown Land, on the terms authorized by Government.

Twenty allotments of land situated in the divisions noted below of the Kurunegala District of the North-Western Province.

Lot.	Village.	Name of Land.	Name of Claimant.	Description.	Extent.
					A. R. P.
Preliminary plan 1,345.—Weudawili hatpattu.					
Upset price,—Rs. 15 per acre.					
6994	Ratgalla	Gallindamula Mukalana	The Crown	Forest	1 3 20
Preliminary plan 597.—Katugampola hatpattu.					
Upset price,—Rs. 11 per acre.					
A 217	Kulliyapitiya	Digiliyagawahena	The Crown	Jungle	3 0 25
Preliminary plan 440.—Weudawili hatpattu.					
Upset price,—Rs. 10 per acre.					
3118	Nahalla	Dawatagahapitiya	The Crown	Paddy	2 0 33
3119	Olagama	Puswelanda	do.	do.	1 1 21
3120	Do.	Olagamawela	do.	do.	3 1 24
3121	Do.	Siyambelagahakotuwa	do.	do.	1 1 19
3124	Do.	Olagamawela	do.	do.	1 3 36
3125	Do.	do.	do.	do.	0 3 12
3126	Do.	Kotuwakumbura	do.	do.	1 1 38
3127	Do.	Bogahamulawatta	do.	Cocoanut garden	0 3 0
3128	Do.	Olagamawela	do.	Paddy	0 2 26
3129	Do.	Bogahamulakamata	do.	Kamata	0 0 20
3130	Do.	Velkotuwa	do.	Paddy	1 1 35
3131	Do.	do.	do.	Owita	0 0 28
3136	Rambodagala	Mahaliyadduvenile	do.	Paddy	2 0 37
3137	Do.	Godapadumile	do.	do.	0 3 30
3138	Do.	Durenile	do.	do.	2 0 0
Preliminary plan 1,951.—Dambadeniya hatpattu.					
Upset price,—Rs. 30 per acre.					
9885	Minitenkula	Mahakumburahena	The Crown	Jungle and forest, contains del and few milla trees	5 3 13
9886	Do.	do.	do.	do.	0 2 6
Preliminary plan 1,833.—Weudawili hatpattu.					
Upset price,—Rs. 25 per acre.					
9266	Murutawa	Amuna	The Crown	Tank in use	5 0 31

Further information respecting these lands may be obtained from the Surveyor-General, and respecting the conditions of sale from the Government Agent, North-Western Province.

By His Excellency the Governor's command,
E. NOEL WALKER,
Colonial Secretary.

No. 1,105, N.-W. P.

වර්ෂ 1894 ක්වු අගෝස්තු මස 14 වෙනි දින කොළඹ

මහසෙනෙවුගේ උන්තාන්තේශ්වරී චන්ද්‍රවේදියා.

වසඹ දිසාවේ ආණ්ඩුවේ ඒජන්ත උන්තාන්තේශ්වරී විසින් මෙහි පහත සඳහන්වෙන ආණ්ඩුව, සන්තක ඉඩම් ආණ්ඩුවේ නියෝගවල ප්‍රකාරයට වර්ෂ 1894 ක්වු ඔක්තෝබර් මස 16 වෙනි දිනවු අගහරුවාදාදාදවල් කුරුනෑගල කවිචේරියේදී වෙන්දේසිකර විකුණන්නට යෙදෙනවා ඇත.

වසඹ දිසාවේ කුරුනෑගල පලාතේ මෙහි පහත සඳහන්වු කොට්ඨාසවල පිහිටා තිබෙන බිම්කැබලි 20ක් සිතියම 1,345. වැරදිවිලිගත්පත්තුව.

නියමකරණලද මුදල අක්කරයකට රුපියල් 15යි.

නො.	ගම.	ඉඩමේ නම.	අයිතියකම් කියන්නා.	අන්දම.	මහත. අ. රු. ප.
6994	රත්ගල්ල	ගල්ලිද මුකලාන	රාජසන්නක	මුකලාන	1 3 20
සිතියම 597. කටුගම්පොල හත්පත්තුව.					
A 217	කුලියාපිටිය	නියමකරණලද මුදල අක්කරයකට රුපියල් 11යි. දිග්ගිලියාගාව හේන	රාජසන්නක	ලදුකැලැව	3 0 25
සිතියම 440. වැරදිවිලි ගත්පත්තුව.					
3118	නගල්ල	නියමකරණලද මුදල අක්කරයකට රුපියල් 10යි. දවටගහපිටිය	රාජසන්නක	කුඹුරුඹිම	2 0 33
3119	බලගම	පුස්වෙලන්ද	එම	එම	1 1 21
3120	එම	බලගම වෙල	එම	එම	3 1 24
3121	එම	සියඹලාගහ කොටුව	එම	එම	1 1 19
3124	එම	බලගම වෙල	එම	එම	1 3 36
3125	එම	එම	එම	එම	0 3 12
3126	එම	කොටුවේ කුඹුර	එම	එම	1 1 38
3127	එම	බෝගහමුල වත්ත	එම	පොල්වත්ත	0 3 0
3128	එම	බලගමවෙල	එම	කුඹුරුඹිම	0 2 26
3129	එම	බෝගහමුල කමත	එම	කමත	0 0 20
3130	එම	වෙල්කොටුව	එම	කුඹුරුඹිම.	1 1 38
3131	එම	එම	එම	ඔව්ට	0 0 28
3136	රම්බොඩගල	මහලියද්දේ දුරනිල	එම	කුඹුරුඹිම	2 0 37
3137	එම	ගොඩපදුනිල	එම	එම	0 3 30
3138	එම	දුරනිල	එම	එම	2 0 0
සිතියම 1,951. දඹදෙනි හත්පත්තුව.					
9885	මිනිකුකුල	නියමකරණලද මුදල අක්කරයකට රුපියල් 30යි. මහකුඹුරේ හේන	රාජසන්නක	කැලැව් සහ දෙලයි මිල්ලයස් සවිල් ප කුසි තිබෙන මුළුලාන	5 3 13
9886	එම	එම	එම	ම	0 2 6
සිතියම 1,833. වැරදිවිලි ගත්පත්තුව.					
9266	මුරුතව	නියමකරණලද මුදල අක්කරයකට රුපියල් 25යි. අමුන	රාජසන්නක	වතුරගත්ත වැව	5 0 31

මෙම ඉඩම් ගැණ වැඩිදුර කාරණා සර්වේශර්ජනරාජ්‍ය උන්තාන්තේශ්වරී, විනිශ්චිත කොන්දේසි ගැණ කාරණා වසඹ දිසාවේ ආණ්ඩුවේ ඒජන්ත උන්තාන්තේශ්වරී දැනගන්නට පුළුවන.

ආණ්ඩුකාර උතුමානන්වහන්සේගේ ආඥාවලෙස,

ජී. නොඑල් වාකර්,
මහසෙනෙවුගේ උන්තාන්තේශ්වරී විසින්.

LAND SALES IN THE PROVINCE OF UVA.

No. 171, P. OF U.

Colonial Secretary's Office,
Colombo, August 24, 1894.

ON Tuesday, October 9, 1894, at noon, the Government Agent for the Province of Uva will put up to auction, at his Office in the Kachcheri, the under-mentioned portions of Crown Land, on the terms authorized by Government.

An allotment of land situated in the Yatikinda division of the Badulla District of the Province of Uva.

Preliminary plan 453.

Lot.	Village.	Name of Land.	Name of Applicant.	Description.	Extent. A. R. P.
1621	Kolumandiya	Kandegedarakapallewela	Mr. T. J. E. Johnson	Patana	87 2 0

Upset price,—Rs. 10 per acre.

Further information concerning these lands may be obtained from the Surveyor-General, and respecting conditions of sale from the Government Agent, Badulla.

By His Excellency the Governor's command,

E. NOEL WALKER,
Colonial Secretary.

No. 171, P. OF U.

වර්ෂ 1894 ක්වූ අගෝස්තු මස 24 වෙනි දින කොළඹ
මහසෙනෙකාරීස්ථානයේ කන්තෝරුවේදී.

ඉහත දිනට අනුමැතියෙන් ඒජන්තාධිපතිවරයා විසින් මෙහි පහත සඳහන්වන අනුමැතිය සහිතව ඉඩම අනුමැතියෙන් නියෝගවල ප්‍රකාරයට වර්ෂ 1894 ක්වූ මක්කෝබර් මස 9 වෙනි දිනට අහඹු වශයෙන් බදුල් 12ට බදුළු කව්වේරියේදී වෙන්දේසිකර විකුණනුට යෙදෙනවා ඇත.

ඉහත දිනට බදුළු පලාතේ යටිකිඳ කොට්ඨාසයේ පිහිටා තිබෙන බිම්කැබලි ලක්.

සිතියම 453. ගම—කොල්මන්විස. ඉල්ලුම්කාරයා—ඒ. ජේ. ජේ. ජෝන්සන්.

නො.	ඉඩමේ නම.	අයිතිකම් කියන්නා.	අන්දම.	මහත. අ. රු. ප.
1621	කන්දේගෙදර කපල්ලේවෙල	අනුමැතිය	පහත	87 2 0

අක්කරයක් රූපියල් 10යේ සිට විකුනනු ලැබේ.

මේ ඉඩම ගැන වැඩිදුරට තොරතුරු සර්වේයර්ජනරාල් උත්තරායේගෙන්ද, විකුණුම ගැන තොරතුරු බදුල්ලේ අනුමැතියෙන් ඒජන්තාධිපතිවරයාගෙන්ද දැනගත හැකිය.

අනුමැතිය උතුමානන්වනන්ගේ අඥාවලෙස,
ඒ. නොල් වාකර්,
මහසෙනෙකාරීස් මහ.

No. 172, P. OF U.

Colonial Secretary's Office,
Colombo, August 24, 1894.

ON Tuesday, October 9, 1894, at noon, the Government Agent for the Province of Uva will put up to auction, at his Office in the Badulla Kachcheri, the under-mentioned portions of Crown Land, on the terms authorized by Government.

Fourteen allotments of land situated in the Yatikinda division of the Badulla District of the Province of Uva.

Preliminary plan 408.
Applicant—Mr. G. Thomson.

Lot.	Village.	Name of Land.	Name of Claimant.	Description.	Extent. A. R. P.
1369	Kanaweralla	Otambeapatana	Crown	Patana and forest	9 3 16
1370	do.	do.	do.	Patana	2 3 16
C 50	Kanduhara	Pinarawę	G. Thomson	New clearing patana	0 3 0
D 50	do.	do.	do.	do.	1 1 24
E 50	do.	do.	do.	Old coffee	0 1 3
F 50	do.	do.	do.	Young tea	0 0 21

Lot.	Village.	Name of Land.	Name of Claimant.	Description	Extent. A. R. P.
Preliminary plan 453. Applicant—Mr. T. J. E. Johnson.					
1619	Kolumandiya	Kandegedarakapallewela	Crown	Patana	28 3 2
1623	Tawalmandiya	Udakohilwila	do.	do.	1 0 4
1624	do.	do.	do.	do.	2 2 38
Preliminary plan 451. Applicant—Mr. P. F. Hadow.					
1611	Hetenne	Tikiri Maditta	Crown	Patana	9 0 27
1613	do.	do.	do.	do.	4 2 23
Preliminary plan 420. Applicant—Mr. G. Thomson.					
1488	Halpe	Ensalledepatana	Crown	Patana.	6 3 14
1491	do	do	do.	do.	35 3 17

Upset price,—Rs. 10 per acre.

Further information concerning these lands may be obtained from the Surveyor-General, and respecting the conditions of sale from the Government Agent, Badulla.

By His Excellency the Governor's command,
E. NOEL WALKER,
Colonial Secretary.

No. 172, P. OF U.

වර්ෂ 1894 ක්වූ අගෝස්තු මස 24 වෙනි දින කොළඹ

මහසෙනෙකාරීජ්ජන්තාන්යේසේ කන්තෝරුවේදීය.

ඉව දියාවේ ආණ්ඩුවේ ඒජන්තජ්ජන්තාන්යේ විසින් මෙහි පහත සඳහන්වෙන ආණ්ඩුව සන්තක ඉඩම් ආණ්ඩුවේ නියෝගවල ප්‍රකාරයට වර්ෂ 1894 ක්වූ මක්කෝබර් මස 9 වෙනි දින වූ අගහරුවාද දවල් 12ට බදු එකවරින්දේ වෙන්දේසිකර විකුණනවට සෛදෙනවා ඇත.

ඉව දියාවේ බදු එපලාහේ සවිකිද කොට්ඨාසයේ පිහිටා තිබෙන බිම්කැබලි.

සිතියම 408. ගම—කනවැරැල්ල. ඉල්ලුම්කාරයා—ජී. තොම්සන් මහත්මයා.

නො.	ඉඩමේ නම.	අයිතිකම නියන්තා.	අන්දම.	මහත. අ. රු. ප.
1369	බිතුඹෙපතන	ආණ්ඩුව	පතන සහ කැලේ	9 3 16
1370	එම	එම	පතන	2 .3 16
ගම—කඳුකර.				
C 50	පින්අරව	ජී. තොම්සන් මහත්මයා	නේ වැව්වට අළුත එළිකල ඉඩම	0 3 0
D 50	එම	එම	එම	1 1 24
E 50	එම	එම	පරණකෝපි	0 1 3
F 50	එම	එම	නේපැල	0 0 21
සිතියම 453. ඉල්ලුම්කාරයා—පී. ජේ. ජේ. ජෝන්සන් මහත්මයා. ගම—කොල්ලේවත්සිය.				
1619	කන්දේගෙදර කපල්ලේ වෙල	ආණ්ඩුව	පතන	28 3 2
ගම—තවලන්මැඩිය.				
1623	ලඬකොහොවිලේ	ආණ්ඩුව	එම	1 0 4
1624	එම	එම	එම	2 2 38
සිතියම 451. ඉල්ලුම්කාරයා—පී. ඇල්. හැබෝ මහත්මයා. ගම—හැහැම්ම.				
1611	විකිරිඹිත්ත	ආණ්ඩුව	පතන	9 0 27
1613	එම	එම	එම	4 2 23
සිතියම 420. ඉල්ලුම්කාරයා—ජී. තොම්සන් මහත්මයා. ගම—හල්පේ.				
1488.	එන්සල්ලාද්දේ පතන	ආණ්ඩුව	පතන	6 3 14
1491	එම	එම	එම	35 3 17

අක්කරේ රූපිපල් 10යේ සිට විකුනනු ලැබේ.

මේ ඉඩම් ගැණ වැඩිදුර කාරණා සර්වේසර්ජන්තරුල්කැනගෙන්ද, විකුනුම ගැණ තොරතුරු ඉවදියාවේ ආණ්ඩුවේ ඒජන්තජ්ජන්තාන්යේගෙන්ද දැනගත හැකිය.

ආණ්ඩුකාර උතුමානන්වහන්සේගේ අවසරයට,
ජී. තොම්ස් වාකර්,
මහසෙනෙකාරීජ්ජන්තාන්යේ.

LAND SALES IN THE PROVINCE OF SABARAGAMUWA.

AMENDED NOTICE.

No. 180, P. OF S. Colonial Secretary's Office,
Colombo, August 10, 1894.

AT noon on Thursday, September 27, 1894, the Government Agent of the Province of Sabaragamuwa will put up to auction for sale, at Balangoda Resthouse, the under-mentioned portions of Crown Land, on the terms authorized by Government.

Twenty-four allotments of land in Uggalkaltota in Helaudapalata of Meda korale.

Lot.	Name of Land.	Description.	Extent.	
			A.	R. P.
Preliminary plan 322.				
765a	Medakinda	Forest and chena	2	1 26
765b	Do.	do.	3	2 20
765c	Do.	do.	3	2 12
801	—	Rocky knoll	5	1 32
802	Gonakandura-ara-yaya	Forest and chena	8	0 0
802a	Do.	Forest and scrub jungle	2	0 29
802b	Do.	Forest and chena	3	0 9
802c	Do.	do.	3	1 10
802d	Do.	do.	1	3 3
802e	Do.	do.	2	3 30
802f	Do.	do.	2	1 36
802g	Do.	do.	1	3 26
802h	Do.	do.	2	3 18
802i	Do.	do.	2	0 20
802j	Do.	do.	2	3 28
802k	Do.	do.	2	0 2
802l	Do.	do.	3	0 11
802m	Do.	do.	3	2 0
802n	Do.	do.	3	2 28
802o	Do.	do.	2	1 14
802p	Do.	do.	3	2 32
802q	Do.	do.	5	1 0
802r	Do.	do.	2	0 28
802s	Do.	do.	3	2 6

Upset price,—Rs. 10 per acre.

Further information respecting these lands may be obtained from the Surveyor-General, and respecting the conditions of sale from the Government Agent, Ratnapura.

By His Excellency the Governor's command,

E. NOEL WALKER,
Colonial Secretary.

වෙනස්කරණලද දැන්වීමයි.

වර්ෂ 1894 ක්වූ අගෝස්තු මස 10 වෙනි
No. 180, P. OF S. දින කොළඹ මහසෙනෙවාරිප්ලන්
නාන්දේසේ කන්දෝරුවේදීය.

අනුමත අයිති මෙහි පහත සඳහන්වෙන බිම්කොට
ආ වස වර්ෂ 1894 ක්වූ සැප්තැම්බර් මස 27 වෙනි

දින මහස්පතින්ද දවල් සබරගමු දිසාවේ ඒජන්තලන්
නාන්දේ විසින් බලන්ගොඩ නානාදමේදී ආණ්ඩුවේ
නියෝගවල ප්‍රකාරයට විකුණනට සෛදෙකවා ඇත.

සබරගමු දිසාවේ මැදකෝරලේ ගෙලලඩ පලාතේ
ලන්ගල් කල්කොට සහ ගම පිහිටි ඉඩප්ලන්වි විසිකත
රක්.

සිතියම 322. අයිතිකම කියත්තා—ආණ්ඩුව.

නො.	ඉඩමේ නම.	අකුම.	අ. රු. ප.
765a	මැදකිඳ	මුකලානසහ හෙන	2 1 26
765b	එම	එම	3 2 20
765c	එම	එම	3 2 12
801	—	කඳු ඉඩම	5 1 32
802	ගෝනකඳුර ආරසාස	මුකලානසහ හෙන්	8 0 0
802a	ගෝනකඳුරසාස	එම සහ සුලු	2 0 29
802b	එම	කැලේ එම සහ හෙන්	3 0 9
802c	එම	එම	3 1 10
802d	එම	එම	1 3 3
802e	එම	එම	2 3 30
802f	එම	එම	2 1 36
802g	එම	එම	1 3 26
802h	එම	එම	2 3 18
802i	එම	එම	2 0 20
802j	එම	එම	2 3 28
802k	එම	එම	2 0 2
802l	එම	එම	3 0 11
802m	එම	එම	3 2 0
802n	එම	එම	3 2 28
802o	එම	එම	2 1 14
802p	එම	එම	3 2 32
802q	එම	එම	5 1 0
802r	එම	එම	2 0 28
802s	එම	එම	3 2 6

අක්කරයක් රුපියල් 10ක බැගින්.

මෙම ඉඩම් ගැණ වැඩිදුර කාරණ සර්වේයර්පහ
රුල්ලන්නාන්දේගෙන්ද, විකිණීමේ කොන්දේසිය
ගැණ කාරණ සබරගමු දිසාවේ ආණ්ඩුවේ ඒජන්ත
ලන්නාන්දේගෙන්ද දැනගන්ට පුළුවන.

ආණ්ඩුකාර උතුමානවනන්දේගේ ආඥාවලය,

ජ. නොඵල් වාකර්,
මහසෙනෙවාරිස් මමක.

LAND ACQUISITION NOTICES.

HAVING been duly directed by the Governor, with the advice of the Executive Council, acting under the provisions of "The Land Acquisition Ordinance of 1876," section 6, to take order for the acquisition of the following land, required for a public purpose, namely, for approaches to Sitala-ganga bridge, to wit :—

Preliminary plan 4,540. Village—Maskeliya.

Lot.	Name of Land.	Description.	Name of Claimant.	Extent. A. R. P.
O 770	Laksapana estate	Spoil formerly tea	Proprietors of Laxapana estate	0 0 20

I hereby give public notice, as required by section 7, that the Government proposes to take possession of the land.

All persons interested in the aforesaid land are hereby required to appear personally or by agent before me at the Kandy Kachcheri on September 17, 1894, at 2 o'clock, and to state the nature of their respective interests in the land, and the amount and particulars of their claims to compensation for such interests.

Kandy Kachcheri,
August 20, 1894.

ALLANSON BAILEY,
Acting Government Agent.

වෑ 1876 ක්ව අවුරුද්දේ නොමිමර 3 වේ ආඥාපත්‍රයේ හත්වෙනි වගන්තියේ ප්‍රකාරයට ආණ්ඩුවේ කටයුත්තට කට, එනම් :—සිතලගල පාරමට යනට පාරක් සැදීම පිණිස මෙහි පහත සඳහන්වන ඉඩම ලබාගැනීම සඳහා ක්‍රියාකරණ පිණිස "වෑ 1876 දේ ඉඩම් ලබාගැනීමේ ආඥාපත්‍රයේ" හවෙනි කාණ්ඩයේ කරතිබෙන පාරාමිතවල ප්‍රකාරයට කාරක මන්ත්‍රීසභාවේ මන්ත්‍රණය ඇතුළු උතුමාහන්වනගේ සේගෙත් නිසිආකාර මට අත ලැබී තිබේ, ඒ ඉඩමනම් :—

සිතියම 4,540. ගම—මස්කෙලිය.

නො.	ඉඩමේ නම.	අන්දම.	අයිතිකම කියන්නා.	මහත. අ. රු. ප.
O 770	ලක්ෂපානවත්ත	ප්‍රථමදී තේවලානිසි දූනට පාච්චට තිබෙනවාය	ලක්ෂපානවත්ත අයිතිකාරයෝ	0 0 20

එබැවින් ඉඩම අයිතිකර ගැනීමට ආණ්ඩුවේ කල්පනාව තිබෙනවට පොළඹනට දූනගැනීම සඳහා හත්වෙනි වගන්තියේ ඔබාකර තිබෙන හැටියට මෙයින් දැනුම්දෙමි.

ඉහතකී ඉඩමට අයිතිවාසිකම් ඇත්තාවූ සැමදෙනම තවුන්ම නොහොත් තවුන් වෙනුවට ක්‍රියා කරණ අස වෑ 1894 ක්ව සැප්තැම්බර් මස 17 වෙනි දින පස්වරු 2 වේ කනිසමට මහනුවර කම්බේරියේදී මා ඉදිරිපිටට පැමිණ ඒ කොසිපන්දමේ අයිතිවාසිකම්ද ක්‍රියා කියාසිටින්නට ඔබාසා සහ මෙම ඉඩම වෙනුවට ඉල්ලාසිටින මුදල් ගණනක් ඊට ඇත්තාවූ තවුන්ගේ අයිතිකමේ තොරතුරුත් කියාසිටින්නට ඔබාසාට මෙයින් දූනගත යුතුයි.

වෑ 1894 ක්ව අගෝස්තු මස 20 වෙනි දින මහනුවර කම්බේරියේදීය.

ආණ්ඩුවේ ඒරන්ත වමිහ.

1876 ම් (බ්‍ර) - ත්තු 3 ම් ඉලක්කස්සැට්තනු 7 ම් පිරිවින ප්‍රකාරය ජිනකකක පාලත්තූක්‍රම් පොක ලොලවෙට්තනු 7 ම් ඉනෙ මුම පහරකතේවෙස්සු වේණදියතන පිනනාස්ලොලවෙට්තනු 7 ම් ආණි භය, අඹ්තාවතු :—

ප්‍රාමපදත්ත ඉලකක 4,540. ශ්‍රීමිස්සි—මස්කෙලිය.

තුණම.	කාණිනිනු පෙපා.	විවරය.	උරිතනාගිනිනු පෙපා.	විචාලය. අ. රු. ප.
O. 770	ලකපානතොලාය	මුනුණු මහපණ්ණි විට්පොතූ පොක මිලවත් ඉලය	ලකපාන තොලාය මොරා	0 0 20

වෙත්තූ කොළඹතනු 7 ම් ඉලක්කස්සැට්තනු 7 ම් පිරිවින ප්‍රකාරය ජිනකකක පාලත්තූක්‍රම් පොක ලොලවෙට්තනු 7 ම් ඉනෙ මුම පහරකතේවෙස්සු වේණදියතන පිනනාස්ලොලවෙට්තනු 7 ම් ආණි භය, අඹ්තාවතු :—

මෙහෙයුම් කාණිකූ උරිතනුපෙපෙකිනෙ ජලවරය තනමක. අලවත අලවත ලොලවෙට්තනු 7 ම් ආණි භය, අඹ්තාවතු :—

1894 ම් (බ්‍ර) ආණිමාස 20 ම් ව. ගවෙණසන් පෙවි, උරිතනු 7 ම් ඉනෙ මුම පහරකතේවෙස්සු වේණදියතන පිනනාස්ලොලවෙට්තනු 7 ම් ආණි භය, අඹ්තාවතු :—

HAVING been duly directed by the Governor, with the advice of the Executive Council, acting under the provisions of "The Land Acquisition Ordinance of 1876," section sixth, to take order for the acquisition of the following lands, to wit :—

Preliminary plan 1,978. Villages—Madampe and Mahawewa.

Lot.	Name of Land.	Description.	Name of Claimant.	Extent.		
				A.	R.	P.
I 980	Portion of title plan 95,448	Paddy	Don David Perera, late Vidane Arachchi, and others	0	0	35.25
J 980	Portion of title plan 94,376	Waste	Philip Jayawardana	0	1	11.25
K 980	Portion of title plan 79,932	do.	do.	0	0	35
L 980	Portion of title plan 114,417	Field	Wirakkodi Pedru Silva and John Mendis, Vidane Arachchi	0	3	3.25
M 980	Do.	Field and waste	Kana Lana Muna Mehammadu Mira Saibu, &c.	0	0	1.75
N 980	Portion of title plan 79,943	do.	Kana Lana Muna Mayadin Sadaku Lebbe	0	0	0.50
O 980	Portion of title plan 79,944	do.	A. N. Mira Saibu	0	0	1.75
P 980	Portion of title plan 79,942	do.	Peruma Duraya and Anohami	0	0	3
Q 980	Portion of title plan 79,945	do.	Daniel Fernando	0	0	3.50
R 980	Portion of title plan 114,417	Part of new cadjan house in course of construction	Juan de Silva Appuhami	0	0	0.87
9928 $\frac{1}{2}$	—	Portion of road	Crown	0	0	12.25
9928 $\frac{3}{4}$	—	Road reservation	do.	0	0	4.50

I hereby give public notice, as required by section 7, that the Government proposes to take possession of the lands.

All persons interested in the aforesaid land are hereby required to appear personally or by agent before me at Mahawewa, on September 26, 1894, at 3 o'clock P.M., and to state the nature of their respective interests in the land, and the amount and particulars of their claims to compensation for such interests.

Chilaw Kachchéri,
August 27, 1894.

E. T. NOYES,
Assistant Government Agent.

විෂ්‍ය 1876 ක්වු අවුරුද්දේ නොමමර 3නේ ආඥාවනුයේ හත්වෙනි වගන්තියේ ප්‍රකාරයට ආණ්ඩුවේ කටයුත්තකට, මෙහි පහත සඳහන්වෙන ඉඩම් ලබාගැනීම පදනා ක්‍රියාකරණ පිණිස "විෂ්‍ය 1876යේ ඉඩම් ලබාගැනීමේ ආඥාවනුයේ" හවෙනි කාණ්ඩයේ කරතිබෙන පංචාර්තුවල ප්‍රකාරයට කාරකමත් ක්‍රියාවේ මත්වුණය ඇතුළු වතුමානවත්වනස්ඵයෙන් තිසිආකාර මට අණලැබී තිබේ, ඒ ඉඩමනම් :—

සිතියම 1,978. කම—මාදම්පේ සහ මහවැව.

නො.	ඉඩමේ නම.	අත්දම.	අයිතිකම කියන්නා.	මහත.
				අ. රු. ප.
I 980	95,448 ඉලක්කමේ පිඟුරෙන් කොටසක්	ඒකුණුර	දෙත් දවත්පෙරු විදුනආරච්චි සහ තවත් අය	0 0 35.25
J 980	94,376 ඉලක්කමේ පිඟුරෙන් කොටසක්	හිස්බිම	පිලිප් ජයවර්ධන	0 1 11.25
K 980	79,932 ඉලක්කමේ පිඟුරෙන් කොටසක්	එම	එම	0 0 35
L 980	114,417 ඉලක්කමේ පිඟුරෙන් කොටසක්	කුණුර	වීරක්කොඩි ජේදුරුසිල්වා සහ ජෝන්මැන්දිස් විදුනආරච්චි	0 3 3.25
M 980	එම	එම සහ හිස්බිම	කානා. ලානා. මුනා. මුහම්මදු මීරසයිඩු සහ තවත් අය	0 0 1.75
N 980	79,943 ඉලක්කමේ පිඟුරෙන් කොටසක්	එම	කානා. ලානා. මුනා. මේයදින් සදක්කලෙබ්බේ	0 0 0.50
O 980	79,944 ඉලක්කමේ පිඟුරෙන් කොටසක්	එම	ඒ. ඇන්. මීරසයිඩු	0 0 1.75
P 980	79,942 ඉලක්කමේ පිඟුරෙන් කොටසක්	එම	පෙරුමාදුරෙයා සහ අනොහාමි	0 0 3
Q 980	79,945 ඉලක්කමේ පිඟුරෙන් කොටසක්	එම	දනියෙල් ප්‍රනාන්දු	0 0 3.50
R 980	114,417 ඉලක්කමේ පිඟුරෙන් කොටසක්	දූනට සාදන්නාවූ පොල්අතු ගෙයින් කොටසක්	ජුවන් ද සිල්වා අප්පුහාමි	0 0 0.87
9928 $\frac{1}{2}$	—	පාරෙන් නොටසක්	මුටුන්න	0 0 12.25
9928 $\frac{3}{4}$	—	පාරේ ප්‍රවේසම සඳහා ඇරැහිබෙන ඉඩම	එම	0 0 4.50

එබැවින් ඉඩම් අයිතිකරගැනීමට ආණ්ඩුවේ කල්පනාව තිබෙනබව පොදුජනසාධ දූනගැන්ම සඳහා හත්වෙනි වගන්තියේ ඕනෑකරතිබෙන හැරියට මෙයින් දැනුම්දෙමි.

ඉහතකී ඉඩම්වලට අයිතිවාසිමික ඇත්තාවූ සැමදෙනම තමුන්ම නොහොත් තමුන් වෙනුවට ක්‍රියාකරණ අය වම් 1894 ක්වු සැප්තැම්බර් මස 26 වෙනි දින සවස 3නේ කතිසමට මහවැව්වේදීමා ඉදිරිපිටට පැමිනඒ කොසි අත්දමේ අයිතිවාසිකමද කියා කියාසිටින්න ඕනෑවා සහ මෙම ඉඩම් වෙනුවට ඉල්ලාසිටින මුදල් ගණනක් ඊට ඇත්තාවූ තමුන්ගේ අයිතිකමේ තොරතුරුත් කියාසිටින්න ඕනෑබව මෙයින් දූනගත යුතුයි.

වම් 1894 ක්වු අගෝස්තු මස 27 වෙනි.
දින හලාවත කවිචේරියේදිස.

ඒ. ටී. නොයිස්,
ආණ්ඩුවේ උපදේශක වම්ක.

1876 ம் வருஷத்து 3 ம் இலக்கச்சட்டத்தினது 7 ம பிரிவின பிரகாரம் பகிரங்க தேவைக்கு வேண்டிய தான பின்னாச சொல்லப்படும் காணியை, அஃதாவது :—

பிரசமபடத்து இலக்கம் 1,978. குறிச்சி—மா தமபையும் மகாவெவையும்.

துணர்.	காணியினது பெயர்.	விவரம்.	உரித்தகங்களின் பெயர்.	விசாலம். ஏ. றா. பெ.
I 980	95,448 காணிப்படத்தினோடாகம்	நெலவயல	தொன தாவித் பெரோரூவு மறு பெரும	0 0 35.25
J 980	94,376 ஷ்ட	வெண்காணி	பிலிப்பு ஜகவாதனை	0 1 11.25
K 980	79,932 ஷ்ட	ஷ்ட	ஷ்ட	0 0 35
L 980	114,417 ஷ்ட	நெலவயல	வீரகொடி பே துறுசிலவாவும யுவான மென்றிஸ்	0 3 3.25
M 980	ஷ்ட	நெலவயலும் வெண்காணியும்	க. ல. மு. முகமது மீராசாய்பு	0 0 1.75
N 980	79,943 ஷ்ட	ஷ்ட	க. வெ. மு. மெய்தின சதகரூ வெவவை	0 0 0.50
O 980	79,944 ஷ்ட	ஷ்ட	எ. என. மீராசாய்பு	0 0 1.75
P 980	79,942 ஷ்ட	ஷ்ட	பெரும தூரயாவும அனோகாமி யும்	0 0 3
Q 980	79,945 ஷ்ட	ஷ்ட	தாணியல பறுஞ்சு	0 0 3.50
R 980	114,417 ஷ்ட	புதிதாககட்டுப்படும் ஒலை விட்டிலொரு பங்கு	யுவான டி சீவா அப்புகாமி முடி	0 0 0.87 0 0 12.25
9928 ¹	—	ரோட்டினோய்க்கு		
9928 ²	—	ரோட்டுகளுக்கேதத நிலத்திலொரு பங்கு		0 0 4.50

எடுத்துக்கொள்வதற்கான எத்தனஞ் செய்யுமடி 1876 ம் வருஷத்து 3 காணி எடுத்துக்கொள்வதைப்பற்றிய சட்டத்தினது 6 பிரிவின ஏற்பாடுகளின் பிரகாரம் மந்திராலோசனைச் சபையினது ஆலோசனையுடன் தேசாதிபதியவர்கள் எனக்குக் கற்றுணையெய்தியுள்ள, அக்காணியை ஆட்சிஒப்புக்கொள்ள அரசாட்சியாரா எண்ணியிருக்கிறா எனபடம் 7 ம பிரிவினபடி வேண்டிய பிரகாரம் நாளை இதனைக்கொண்டு பிரசித்தமாய் விளம்பரஞ்செய்க்கிறேன்.

மேற்கூறிய காணிகளுக்கு உரித்துப்பேசுகின்ற சகலரும் தாமாக அல்லது அவரவருடைய தாரியகாரா மூலமாய் 1894 ம் வருஷ புரட்டாசிமாசம் 26 ந்தேதியிலன்று 3 மணிக்கு மகாவெவையில் எனமுன்பாக வெளிப்படாத கத்தமகரூ அக்காணியிலுள்ள உடந்தைகளினது தன்மையையும் அவ்வுடந்தைகளுக்காய்த் தாம் சாதிக்கும் உரித்தகனின் தொகையையும் விவரங்களைபும் சொல்லுமடி இதனால் அவர்களிடத்தில் கேட்பிக்கொள்ளப்படுகின்றது.

சில்பாக் கச்சேரி,
1894 ம் வருஷ ஆவணிமீ 27 ந் வ.

க. நீ. தொயில,
அரசாட்சி உதவி ஏசண்டி.

LAND RESUMPTION NOTICES.

WHEREAS all the allotment of land described in title plan 46,893, known as "Nunuvil Chempadu," situated in the village Mirusuvil in the parish of Elutumadduval in the Tenmaradchi division in the Jaffna District, Northern Province—bounded on the east by the property of Sinnatamby Kanapathy and brothers, Nakar Vairavy, Kantar Vairavy, Velauthar Kanapathy and shareholders, and Crown land; north by the property of Teivanai, wife of Kadirkamar, Vairamoto Kadirkamar, Kantar Tirumeny, Kantappan Sanmukam, Valliammai, wife of Vairavanatar, Putattampy Kanapathippillai, and Velauther Sithamparappillai and shareholders; west by Crown land and property of Vaitty Nikkilan, Pedroe Nikkilan, Sinnatamby Vaittiampillai, Marian Santio, Marian Nikkilappillai and shareholders; and on the south by the property of Sayampunatar Asaippillai and road—containing in extent 175 acres 1 rood 25 perches more or less, which has been alienated by and on behalf of the Crown, appears to me to have been abandoned by the owner thereof for the last eight years and upwards; and whereas such owner or any person lawfully claiming under him cannot be ascertained, notwithstanding all diligent and reasonable inquiries thereunto made by me:

Now know all Men concerned that I, William Crofton Twynam, C.M.G., Government Agent of the Northern Province, by virtue of the powers vested on me by the Land Resumption Ordinance of 1887, and with the sanction of His Excellency the Governor, do hereby declare that if no claim to the said land by any person having a right or able to establish a title thereto is made to me on or before August 31, 1895, the same will be resumed by the Crown in terms of the 3rd clause of the said Ordinance.

Given under my hand at Jaffna this 20th day of July, 1894.

W. C. TWYNAM,
Government Agent.

சென்னை சர்க்கார் அரசாங்கத்தால் உத்தேசிக்கப்பட்ட பகுதியில் எழுதப்பட்ட மொத்த கோயில்பற்றைச் சேர்ந்த மிருகவிலையுள்ளதும் 46,893 ம் நொம்பர் உரிமைப்படத்தில் விவரமாகச் சொல்லப்பட்டிருக்கிற துமாகிய துணுவில் செம்பாடி என்னும் காணியின் எல்லை: கிழக்கு சின்னத்தம்பி கணபதிக்கும் சகோதரருக்கும், நாகர்வையலிக்கும், கந்தாவையலிக்கும், வேலாயுதர் கணபதிக்கும் பங்காளருக்கும் உடைய ஆதனமும் முடிக்குரிய காணியும்; வடக்கு—சுதிராசார் பெண் தெய்வானைக்கும், வையமுத்து சுதிராசார்ருக்கும் கந்தர் திருமேனிக்க்கும், கந்தப்பர் சண்முகத்துக்கும், வையவநாதர் பெண் வள்ளியம்மைக்கும், பூத்த தம்பி கணபதி பிள்ளைக்கும், வேலாயுதர் சிதம்பரப்பிள்ளைக்கும், பங்காளருக்கும் உடைய ஆதனம்; மேற்கு—முடிக்குரிய காணியும் வைத்தி நீக்கிலானுக்கும், பேதுரு நீக்கிலானுக்கும், சின்னத்தம்பி வைத்தியாப்பிள்ளைக்கும், மரியான சந்தியோவுக்கும், மரியான நீக்கிலாப்பிள்ளைக்கும், பங்காளருக்கும் உடைய ஆதனம்; தெற்கு—சயம்புநாதர் ஆசைப்பிள்ளையுடைய ஆதனமும் தெருவும்.

இலங்கைத்தீவில் வடமாகாணம் யாழ்ப்பாண மூலதிகக்கைச்சேர்ந்த தென்மருட்சிப் பகுதியில் எழுதப்பட்ட மொத்த கோயில்பற்றைச் சேர்ந்த மிருகவிலையுள்ளதும் 46,893 ம் நொம்பர் உரிமைப்படத்தில் விவரமாகச் சொல்லப்பட்டிருக்கிற துமாகிய துணுவில் செம்பாடி என்னும் காணியின் எல்லை: கிழக்கு சின்னத்தம்பி கணபதிக்கும் சகோதரருக்கும், நாகர்வையலிக்கும், கந்தாவையலிக்கும், வேலாயுதர் கணபதிக்கும் பங்காளருக்கும் உடைய ஆதனமும் முடிக்குரிய காணியும்; வடக்கு—சுதிராசார் பெண் தெய்வானைக்கும், வையமுத்து சுதிராசார்ருக்கும் கந்தர் திருமேனிக்க்கும், கந்தப்பர் சண்முகத்துக்கும், வையவநாதர் பெண் வள்ளியம்மைக்கும், பூத்த தம்பி கணபதி பிள்ளைக்கும், வேலாயுதர் சிதம்பரப்பிள்ளைக்கும், பங்காளருக்கும் உடைய ஆதனம்; மேற்கு—முடிக்குரிய காணியும் வைத்தி நீக்கிலானுக்கும், பேதுரு நீக்கிலானுக்கும், சின்னத்தம்பி வைத்தியாப்பிள்ளைக்கும், மரியான சந்தியோவுக்கும், மரியான நீக்கிலாப்பிள்ளைக்கும், பங்காளருக்கும் உடைய ஆதனம்; தெற்கு—சயம்புநாதர் ஆசைப்பிள்ளையுடைய ஆதனமும் தெருவும்.

20 වෙනි දින ජනවාරි 20 වෙනි දින ජනවාරි 20 වෙනි දින

විකිලි. සී. විවේචනම්, ඒජන්ත උන්කාන්සේ.

இலங்கைத்தீவில் வடமாகாணம் யாழ்ப்பாண மூலதிகக்கைச்சேர்ந்த தென்மருட்சிப் பகுதியில் எழுதப்பட்ட மொத்த கோயில்பற்றைச் சேர்ந்த மிருகவிலையுள்ளதும் 46,893 ம் நொம்பர் உரிமைப்படத்தில் விவரமாகச் சொல்லப்பட்டிருக்கிற துமாகிய துணுவில் செம்பாடி என்னும் காணியின் எல்லை: கிழக்கு சின்னத்தம்பி கணபதிக்கும் சகோதரருக்கும், நாகர்வையலிக்கும், கந்தாவையலிக்கும், வேலாயுதர் கணபதிக்கும் பங்காளருக்கும் உடைய ஆதனமும் முடிக்குரிய காணியும்; வடக்கு—சுதிராசார் பெண் தெய்வானைக்கும், வையமுத்து சுதிராசார்ருக்கும் கந்தர் திருமேனிக்க்கும், கந்தப்பர் சண்முகத்துக்கும், வையவநாதர் பெண் வள்ளியம்மைக்கும், பூத்த தம்பி கணபதி பிள்ளைக்கும், வேலாயுதர் சிதம்பரப்பிள்ளைக்கும், பங்காளருக்கும் உடைய ஆதனம்; மேற்கு—முடிக்குரிய காணியும் வைத்தி நீக்கிலானுக்கும், பேதுரு நீக்கிலானுக்கும், சின்னத்தம்பி வைத்தியாப்பிள்ளைக்கும், மரியான சந்தியோவுக்கும், மரியான நீக்கிலாப்பிள்ளைக்கும், பங்காளருக்கும் உடைய ஆதனம்; தெற்கு—சயம்புநாதர் ஆசைப்பிள்ளையுடைய ஆதனமும் தெருவும்.

இந்த எல்லைக்குட்பட்டவருக்கும் ஏறக்குறைய 175 ஏக்கர், 1 ஊடம், 25 பேட்சு அளவையுடைய நிலத்தை கவற்றன்மேந்தார் பிறநீங்கல்படுத்தியிருந்தும் அந்த நிலமுடையவர் சென்ற எட்டு வருஷத்துக்கும் அதற்கு மேலதனமான சாலந்துவச்சும் ஆட்சிபண்ணவில்லை யென்பது எனக்குத் தெரியவந்தபடியால் அந்த நிலமுடையவ ரின்ற ரென்று அறிவதற்குவேண்டிய சாக்கிரத்தையானவும் நீதியுமான விசாரணைசெய்தும் அறிந்துகொள்ளமுடியாப் படியால்.

இத்தால் சகலரு மறியவேண்டியது, வில்லியம் குறவுற்றன் துவைனம், சி.எம்.ஜி., வடமாகாணம் கவற்றன்மேந்து ஏசண்டித்துரையாகிய எனக்கு 1887 ம் ஆண்டின் விற்றகாணிகளை திரும்பவும் கவற்றன்மேந்துக் கெடுத்துக்கொள்ளும்பொருட்டு உண்டுபண்ணிய சட்டனைச்சட்டத்தின் பெலப்பைக்கொண்டும் உத்தம தேசாதிபதி யவர்களின் உத்தரவைக்கொண்டும் அறிவிக்கிறதாவது: மேற்குறித்த நிலத்தப்பற்றி எவராவது உரித்துப்பேசுகிற வர்கள் 1895 ம் ஆண்டு ஆவணிமாசம் 31 ந் தேதி அல்லது அதற்கு முன்பவந்து வெளிப்பட்டு அவர்களின் இரித்தையும் பெலப்பையும் காண்பியாதிருக்கில் மேற்குறித்த சட்டத்தின் 3 ம் பிரிவின் பிரகாரம் திரும்பவும் கவற்றன்மேந்துக்கு எடுத்துக்கொள்ளப்படும்.

யாழ்ப்பாணம் சச்சேரி, 1894 ம் ஆண்டு ஆடிமீ 20 ந் வ.

டபிள்யூ. சி. துவைனம், அரசாட்சி ஏசண்டு.

IT is hereby declared that the village Welipenna of Pasdun-Walallawiti korale in Kalutara District—bounded on the north by the villages Horawala, Parawala, and Henagama in the Iddagoda pattu of Pasdun korale, on the east by the villages Madawala and Uragoda in Walallawiti korale, on the south by the village Lewuwanduwa in Walallawiti korale, and on the west by Welipenna-ganga and by the village Henpita—declared as an infected area in terms of the 3rd clause of the Ordinance No. 9 of 1891, and published in the Government Gazette of August 24, 1894, is free from disease, and no longer an infected area.

Kalutara Kachechi, H. W. BRODHURST, August 28, 1894. Assistant Government Agent.

on the west by Maguru-ganga and Kalugalmukalana—declared as an infected area in terms of the 3rd clause of the Ordinance No. 9 of 1891, and published in the Government Gazette of July 20, 1894, are free from disease, and no longer an infected area.

H. W. BRODHURST, Assistant Government Agent. Kalutara Kachechi, August 28, 1894.

IT is hereby declared that the villages Baduraliya, Magura, Kamburawala, Penigala, Midalana, and Dehipitiya, all of Pasdun korale—bounded on the north by Latpandura village, on the east by Morapitiya village, on the south by Atale village, all in Pasdun korale, and

IT is hereby declared that the village Potuwewa in Maminiya korale—bounded on the north by the Kadaima, east by the Kadiya-oja, south by the Kadaima, and west by the Maminiyawe-ela, all of Maminiya korale—is an infected area according to the 4th and 5th clauses of the Ordinance No. 9 of 1891.

H. NEVILL, Government Agent. Anuradhapura Kachechi, August 27, 1894.